


Barah madani kaam (Gujarati)



દા'વતે ઈસ્લામી કે ઝૈલી હલકે કે 12 મદની કામ, મદની કામોં કે અહદાફ, મદની કામોં કા તરીકએ કાર, મદની કામોં કી અહમ્મિયત વ ફઝાઈલ પર રંગ બિરંગે મદની ફૂલોં સે માલામાલ મદની ગુલદસ્તા

બૈરને મુલક કે ઈસ્લામી ભાઈયોં કે લિયે

બારહ મદની કામ



પેશકશ : મર્કઝી મજલિસે શૂરા
(દા'વતે ઈસ્લામી)

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ أَمَا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ ط

કિતાબ પઢને કી દુઆ

અઝ: શેખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી, હઝરતે અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી રઝવી دامت برکاتہم العالیہ

દીની કિતાબ યા ઈસ્લામી સબક પઢને સે પહલે ઝૈલ મેં દી હુઈ દુઆ પઢ લીજિયે إِنْ شَاءَ اللهُ تَعَالَى જો કુછ પઢેંગે યાદ રહેગા . દુઆ યેહ હૈ :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તર્જમા: ઐ અલ્લાહ عَزَّوَجَلَّ ! હમ પર ઈલ્મોહિક્મત કે દરવાઝે ખોલ દે ઓર હમ પર અપની રહમત નાઝિલ ફરમા ! ઐ અઝમત ઓર બુઝુર્ગી વાલે !

નોટ : અવ્વલ આબિર એક-એક બાર દુરૂદ શરીફ પઢ લીજિયે.

તાલિબે ગમે મદીના

બકીઅ

વ મગફિરત



13 શવ્વાલુલ મુકર્રમ 1428 હિ.

કિયામત કે રોઝ હસરત

ફરમાને મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : સબ સે ઝિયાદા હસરત કિયામત કે દિન ઉસ કો હોગી જિસે દુન્યા મેં ઈલ્મ હાસિલ કરને કા મૌકઅ મિલા મગર ઉસ ને હાસિલ ન કિયા ઓર ઉસ શખ્સ કો હોગી જિસ ને ઈલ્મ હાસિલ કિયા ઓર દૂસરોં ને તો ઉસ સે સુન કર નફઅ ઉઠાયા લેકિન ઉસ ને ન ઉઠાયા (યા'ની ઉસ ઈલ્મ પર અમલ ન કિયા)

(તારિખ દમશ્ક લાઇન એસાકા, જ ૦૧ વ ૧૩૮ ડારલ્ ફકર બીરુત)

કિતાબ કે ખરીદાર મુતવજ્જેહ હો

કિતાબ કી તબાઅત મેં નુમાયાં ખરાબી હો યા સફહાત કમ હોં યા બાઈન્ડિંગ મેં આગે પીછે હો ગએ હોં તો મક્તબતુલ મદીના સે રુજૂઅ ફરમાઈયે.

“બારહ મદની કામ” કા ગુજરાતી રસ્મુલ ખત

اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ દા'વતે ઈસ્લામી કી મજલિસ “અલ મદીનતુલ ઈલ્મિયા” ને યેહ રિસાલા ‘ઉર્દૂ’ ઝબાન મેં પેશ ક્રિયા હૈ ઓર મજલિસે તરાજિમ ને ઈસ રિસાલે કા ‘ગુજરાતી’ રસ્મુલ ખત (લીપિયાંતર) કરને કી સઆદત હાસિલ કી હૈ [ભાષાંતર (Translation) નહીં બલ્કિ સિર્ફ લીપિયાંતર (Transliteration) યા’ની બોલી તો ઉર્દૂ હી હૈ જબ કિ લીપિ (લિખાઈ) ગુજરાતી કી ગઈ હૈ] ઓર મક્તબતુલ મદીના સે શાએઅ કરવાયા હૈ.

ઈસ રિસાલે મેં અગર કિસી જગહ કમી-બેશી યા ગલતી પાએં તો **મજલિસે તરાજિમ** કો (બ ઝરીઅએ Sms, E-mail યા Whats App બ શુમૂલ સફહા વ સતર નમ્બર) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

ઉર્દૂ સે ગુજરાતી રસ્મુલ ખત કા લીપિયાંતર ખાકા

થ = تھ	ત = ت	ફ = ف	પ = پ	ભ = بھ	બ = ب	અ = ا
છ = چ	ચ = چ	ઝ = جھ	જ = ج	સ = س	ઠ = ٹھ	ટ = ٹ
ઝ = ذ	ઢ = ڈھ	ડ = ڈ	ધ = دھ	ઢ = د	ખ = خ	હ = ح
શ = ش	સ = س	ઝ = ز	ઝ = ز	ઢ = ڈھ	ડ = ڈ	ર = ر
ફ = ف	ગ = غ	અ = ع	ઝ = ظ	ત = ط	ઝ = ض	સ = ص
મ = م	લ = ل	ઘ = گھ	ગ = گ	ખ = کھ	ક = ک	ક = ق
ી = ی	ૂ = و	ا = آ	ی = ی	હ = ہ	و = و	ن = ن

-: રાબિતા :-

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

મદની મર્કઝ, કાસિમ હાલા મસ્જિદ, સેકન્ડ ફ્લોર, નાગર વાડા મેન રોડ,

બરોડા, ગુજરાત, અલ હિન્દ, Mo. 09327776311

E-mail : translation.baroda@dawateislami.net

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِيْنَ
اَمَّا بَعْدُ فَاَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ ط بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ط

બારહ મદની કામ

દુરૂદ શરીફ કી ફઝીલત

હઝરતે સય્યિદુના અબ્દુલ્લાહ બિન અમ્ર **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا** ફરમાતે હેં : **مَنْ صَلَّى عَلَيَّ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَاجِدَتْهُ** જો શખ્સ દો આલમ કે માલિકો મુખ્તાર બિ ઈઝને પરવર દગાર, મક્કી મદની સરકાર **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** પર એક બાર દુરૂદે પાક પઢેગા : **صَلَّى اللهُ عَلَيْهِ وَمَلَائِكَتُهُ سَبْعِينَ مَرَّةً** ઉસ પર **اللَّهُ** તઆલા ઓર ઉસ કે ફિરિશ્તે 70 મરતબા રહમત ભેજેંગે. (1)

રહમત ન કિસ તરહ હો ગુનાહગાર કી તરફ

રહમાન ખુદ હે મેરે તરફદાર કી તરફ (2)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٌ

નેકી કી દા'વત કા મદની સફર

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો! **عَزَّوَجَلَّ** ને ઈસ દીન કી હિફાઝત કે લિયે હર દૌર મેં એસે અફરાદ પૈદા કિયે, જિન્હોં ને ન સિર્ફ ઈસ દીને મતીન (મઝબૂત દીન) પર ખુદ અમલ કિયા,

1.....مسند احمد، مسند عبد الله بن عمرو بن العاص، 599/3، حديث: 2925

2.....ઝીકે ના'ત, સ. 111

बल्कि दूसरों तक इस की ता'लीमात पहुंचाने और नेकी की दा'वत आम करने की भी त्तरपूर कोशिश इरमाई है मगर याद रभिये !

अल्लाह **عَزَّوَجَلَّ** हर चीज पर कादिर है, वोड हरगिज हरगिज किसी का मोडताज नहीं, उस ने अपनी कुदरते कामिला से इस दुन्या को बनाया, इसे तरड तरड से सजा कर इस में इन्सानों को बसाया, इर इन की ह्रदायत के लिये वक्तन इ वक्तन रुसुल व अम्बिया **عَلَيْهِمُ الصَّلَاةُ وَالسَّلَام** को मभउस इरमाया (या'नी भेजा). वोड अगर याडे तो अम्बियाअे किराम **عَلَيْهِمُ الصَّلَاةُ وَالسَّلَام** के भिगैर भी भिगडे हुवे इन्सानों की इस्लाह कर सकता है, लेकिन उस की मरजी कुछ इस तरड है कि उस के बन्दे नेकी की दा'वत दें और उस की राड में मशककतें जेल कर भारगाडे आली से भुलन्द दरजात पाअें. युनान्थे,

अल्लाह **عَزَّوَجَلَّ** अपने रसूलों और नभियों **عَلَيْهِمُ الصَّلَاةُ وَالسَّلَام** को नेकी की दा'वत के लिये दुन्या में भेजता रडा और आभिर में अपने प्यारे डभीब, डभीबे लभीब **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** को मभउस किया और आप **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** पर सिलसिलअे नभुवत भत्त इरमाया.

इर येड अजीमुशान मन्सब अपने प्यारे मडभूब **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** की प्यारी उम्मत के सिपुई किया कि भुद ही आपस में अेक दूसरे की इस्लाह करते रहें और नेकी की दा'वत के इस अडम इरीजे को सर अन्जाम दें. युनान्थे, मककअे मुकर्रमा **رَادَهَا اللهُ شَرَفًا وَتَعْظِيمًا** में मडभूबे रडे डावर, शईअे रोजे मडशर **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** ने अपनी

ઇનફિરાદી કોશિશ સે ઇસ્લામ કી દા'વત કો આમ ક્રિયા ઓર ઇસ કામ મેં સહાબએ કિરામ **عَلَيْهِمُ الرِّضْوَان** ને ભી જો ઇશાઅતે ઇસ્લામ મેં મુઆવનત ફરમાઈ વોહ અપની મિસાલ આપ હૈ. મિસાલ કે તૌર પર જબ ઇસ સર ઝમીન મેં નૂરે ઇસ્લામ કી કિરનેં પહુંચીં કિ અન કરીબ જિસે દારુલ હિજરત, મદીનતુન્નબી ઓર મદની મર્કઝ બનને કા શરફ હાસિલ હોને વાલા થા, તો વહાં કે રહને વાલોં ને બૈઅતે ઉકબએ ઊલા કે બા'દ હાદિયે આલમ, શાહે બની આદમ **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** કી બારગાહે બે કસ પનાહ મેં અર્ઝ કી : કોઈ ઐસા મુબદિલગ ઇન કે હાં ભેજા જાએ, જો ન સિર્ફ ઇન કે અલાકે (Area) મેં નેકી કી દા'વત આમ કરે, બલકિ લોગોં કો કુરઆને કરીમ કી તા'લીમાત (Teachings) સે ભી આરાસ્તા કરે. યુનાન્ચે, **أَبُو** **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** કે પ્યારે હબીબ, હબીબે લબીબ **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** ને હઝરતે સય્યિદુના મુસ્અબ બિન ઉમૈર **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** કો મુન્તખબ (Select) ફરમાયા. આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** નબુવ્વત કે ગ્યારહવેં સાલ બ મુતાબિક સિને 620 ઇસવી કો મદીનએ મુનવ્વરા પહુંચે ઓર સિર્ફ 12 માહ કે કલીલ અર્સે મેં આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** ને ઇસ બેહતરીન અન્દાઝ મેં નેકી કી દા'વત આમ કી, કિ મદીને શરીફ કા કૂયા કૂયા ઓર ગલી ગલી ઝિકે ખુદા ઓર ઝિકે મુસ્તફા કે અન્વાર સે જગ મગાને લગા. હર તરફ દીને ઇસ્લામ કે ચર્ચે ફૈલ ગએ. બચ્ચા હો યા જવાન, હર એક કે દિલ મેં ઇશકે મુસ્તફા કી શમ્મ ફરોઝાં (રૌશન)

હો ગઈ. ફિર હજ કે મૌસિમ મેં આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** 70 અન્સાર કા એક મદની કાફિલા લે કર બારગાહે રિસાલત મેં હાઝિર હુવે ઓર યૂં ભૈઅતે ઉકબએ સાનિયા મેં અન્સારે મદીના કે શુરકાએ કાફિલા કો દીદારે મુસ્તફા કી દૌલત પા કર સહાબી હોને કા શરફ મિલા. ⁽¹⁾

મેં મુબલ્લિગ બનૂં સુન્નતોં કા, ખૂબ ચર્યા કરૂં સુન્નતોં કા
યા ખુદા ! દર્સ દૂં સુન્નતોં કા, હો કરમ ! બહરે પાકે મદીના ⁽²⁾

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ઈનફિરાદી કોશિશ કા નતીજા

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હઝરતે સચ્ચિદુના મુસ્અબ બિન ઉમૈર **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** કે ઝરીએ જલ્દ ઈસ્લામ કી દા'વત મદીનએ તચ્ચિબા કે ઘર ઘર મેં પહુંચ ગઈ, યેહ આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** કી ઉસ હદ દરજા ઈનફિરાદી કોશિશ કા નતીજા થા, જો આપ ને રાત દિન જારી રખી. આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** ને તબ્લીગે કુરઆનો સુન્નત કો આમ કરને કે લિયે દિન રાત કી પરવા કિયે બિગૈર જબ ભી, જહાં ભી નેકી કી દા'વત પેશ કરને કે લિયે જાના પડા, કભી ભી સુસ્તી સે કામ ન લિયા.

સુન્નત હે સફર દીન કી તબ્લીગ કી ખાતિર

મિલતા હે હમેં દર્સ યેહ અરફારે નબી સે ⁽³⁾

..... طبقات كبرى، ٣٥- مصعب الخير، ٣/٨٨

²વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 189

³વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 406

اَلْحَمْدُ لِلّٰهِ عَلَيْهِ السَّلَامُ નેકી કી દા'વત કા યેહ સફર યૂં હી જારી વ
 સારી હૈ ઓર اِنْ شَاءَ اللّٰهُ عَلَيْهِ السَّلَامُ તા કિયામે કિયામત જારી રહેગા,
 સહાબએ કિરામ عَلَيْهِمُ الرِّضْوَانُ કે બા'દ જબ ભી પ્યારે આકા
 صَلَّى اللّٰهُ تَعَالٰى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ કી દુખ્યારી ઉમ્મત બે અમલી કે દલદલ મેં ફંસી
 તો اَللّٰهُمَّ عَزَّوَجَلَّ ને અપને કિસી નેક બન્દે કે ઝરીએ ઉસ કી
 નજાત કી રાહેં પૈદા ફરમાઈ. યુનાન્યે, પન્દરહવીં સદી હિજરી મેં
 ભી હાલાત કુદુષ એસે હી હુવે તો ઈન નાઝુક હાલાત મેં શૈખે તરીકત,
 અમીરે અહલે સુન્નાત, બાનિયે દા'વતે ઈસ્લામી હઝરતે અલ્લામા
 મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી રઝવી
 ઝિયાઈ اَمّت بَرَكَاتُهُمُ الْعَالِيَةِ ને દા'વતે ઈસ્લામી કે મદની કામ કા આગાઝ
 કિયા. આપ اَللّٰهُمَّ عَزَّوَجَلَّ વ રસૂલ صَلَّى اللّٰهُ تَعَالٰى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ કી
 મહબ્બત મેં ડૂબ કર પ્યારે આકા صَلَّى اللّٰهُ تَعَالٰى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ કી પ્યારી ઉમ્મત
 કી ઈસ્લાહ કી ખાતિર ચલતે રહે ઓર ફિર દેખતે હી દેખતે આપ કે
 શબો રોઝ કી કોશિશોં, દુઆઓં, ખૌફે ખુદા વ ઈશકે મુસ્તફા ઓર
 ઈખ્લાસ વ ઈસ્તિકામત, હુસ્ને અખ્લાક વ શફકત, ગમ ખ્વારી વ
 મિલન સારી કી બરકત સે મુસલમાન મર્દ વ ઓરત બિલ ખુસૂસ
 નૌજવાન ઝૌક દર ઝૌક દા'વતે ઈસ્લામી કે મદની માહોલ મેં શામિલ
 હોને લગે. બે નમાઝી, નમાઝી બને, ચોર, ડાકૂ, ઝાની વ કાતિલ,
 જુવારી વ શરાબી ઓર દીગર જરાઈમ પેશા અફરાદ તાઈબ હો કર
 મુઆશરે કે અચ્છે અફરાદ બન કર اَللّٰهُمَّ عَزَّوَجَلَّ ઓર ઉસ કે
 રસૂલ صَلَّى اللّٰهُ تَعَالٰى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ કી ઈતાઅત વ ફરમાં બરદારી મેં લગ ગએ,

દાઢી મુન્ડાને વાલે, અપને ચેહરે પર મહબ્બતે રસૂલ કી નિશાની સુન્નત કે મુતાબિક એક મુઢ્ઢી દાઢી સજાને બલિક ઝુલ્ફેં રખને વાલે બન ગએ, અગયાર કી તરહ નંગે સર ફિરને વાલે, સબ્જ ગુમ્બદ કી યાદોં સે માલા માલ સબ્જ સબ્જ ઈમામા શરીફ સજાને લગે.

ઉન કા દીવાના ઈમામા ઓર ઝુલ્ફો રીશ મેં
વાહ ! દેખો તો સહી લગતા હે કેસા શાનદાર (1)

صَلُّوْا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

દા'વતે ઈસ્લામી કા મદની સફર

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! તબ્લીગે કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત **دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ** કી મદની સોચ, ઉમ્મત કે દર્દ મેં સુલગતે દિલ ઓર નેકી કી દા'વત મેં હરીસ તબીઅત કા નતીજા હે. આપ કી તડપ હે કિ હર મુસલમાન હકીકી તૌર પર ગુલામિયે મુસ્તફા કા પટ્ટા અપને ગલે મેં ડાલ લે ઓર સુન્નતોં કી ચલતી ફિરતી ઐસી તસ્વીર નઝર આએ કિ ઉસે દેખ કર મદીને કા વોહ મન્ઝર યાદ આ જાએ, જો મદીને કે પહલે મુબલિગ યા'ની હઝરતે સચ્ચિદ્દના મુસ્અબ બિન ઉમૈર **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** કી નેકી કી દા'વત સે મુતઅસ્સિર હો કર મદીને મેં સરકારે વાલા તબાર **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** કી આમદ કે મૌકઅ પર નઝર આયા થા. યા'ની જિસ તરહ આમદે સરકાર પર હર તરફ ખુશિયોં કા સામાં થા, ઈમામે ઝન્ઝે બના કર

1વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 221

लहराये जा रहे थे, हर तरफ़ ज़बानों पर महल्लत व अकीदत के तराने थे, ईसी तरल घर घर में ईशके मुस्तफ़ा की ऐसी शम्न रौशन हो जाये कि जिस की रौशनी में राहे आभिरत का हर मुसाफ़िर अपनी मन्जिल पर रवां दवां रहे और कल्मी रास्ते से लटके न कल्मी रास्ते की मुश्किलात व मसाईल से थक हार कर बैठे. दा'वते ईस्लामी का जब आगाज़ हुवा तो अव्वलन न कोई शो'बा था न कोई दर्सी किताब, कोई मुबदिलग था न कोई मुअदिलम, मदनी मराकिज थे न मदारिस व ज़ामिआत, बल्कि कोई काम करने का वाज़ेह तरीक़ाये कार तक मौजूद न था और अगर यूं कहा जाये कि दा'वते ईस्लामी हकीकत में शैभे तरीक़त, अमीरे अहले सुन्नत **دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ** की जाते वाहिद का नाम था तो बेजा न होग़ा.

मीठे मीठे ईस्लामी लाईयो ! येह अमीरे अहले सुन्नत **دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ** की पुर फ़ुलूस दुआओं, अन्थक कोशिशों, बेहतरीन डिक्मते अमली और मज़बूत दस्तूरुल अमल का नतीज़ा है कि **الْحَمْدُ لِلَّهِ عَلَيْهِ** येह मदनी तहरीक, मुप्तसर से अर्से में अेक मुनज़्ज़म तन्जीम की शक़ल ईप्तियार कर चुकी है, जिस की जैली मुशावरतों ता मर्कज़ी मजलिसे शूरा, हज़ारों जिम्मादारान और दुन्या लर में लाफ़ों लाफ़ मुन्सलिक ईस्लामी लाईयों का ठाठें मारता समन्दर नज़र आता है, लाफ़ों लाफ़ ईस्लामी बहनें ली पर्दे में रह कर मदनी कामों में मस़ूफ़े अमल हें.

में अकेला ही यला था जानिबे मन्जिल मगर

ईक ईक आता गया कारवां बनता गया

સબ સે પહલા મદની કામ

સબ સે પહલા મદની કામ, જિસ સે શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત **وَأَمَّا بِرَكَاتِهِمُ الْعَالِيَةِ** ને દા'વતે ઈસ્લામી કે મદની કામ કા સિલસિલા શુરૂઅ ફરમાયા, વોહ હફતાવાર સુન્નતોં ભરા ઈજતિમાઅ હૈ, યહાં સે આપ ને ઈજતિમાઈ ઔર ઈનફિરાદી કોશિશ કે ઝરીએ નેકી કી દા'વત કા સિલસિલા બઢાયા, ફિર મસાજિદે અહલે સુન્નત મેં દર્સ કા સિલસિલા શુરૂઅ હુવા તો અવ્વલન હુજજતુલ ઈસ્લામ ઈમામ મુહમ્મદ ગઝાલી **عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْوَالِي** કી મશહૂર તસ્નીફ મુકાશફતુલ ફુલૂબ સે દર્સ દિયા જાતા રહા. ફિર શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત **وَأَمَّا بِرَكَاتِهِمُ الْعَالِيَةِ** ને ગોશએ તખ્લાઈ અપનાઈ ઔર પ્યારે આકા **صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** કી પ્યારી ઉમ્મત કો બે શુમાર સુન્નતોં કા મજમૂઆ ફૈઝાને સુન્નત કી સૂરત મેં અતા ફરમાયા. ફિર દા'વતે ઈસ્લામી કા મદની કામ બઢને કી બરકત સે મુખ્તલિફ શહરોં મેં હફતાવાર સુન્નતોં ભરે ઈજતિમાઆત કા ઈનઈકાદ શુરૂઅ હુવા. બાબુલ મદીના કરાચી સે ઉઠને વાલી મદની તહરીક દેખતે હી દેખતે બાબુલ ઈસ્લામ (સિન્ધ), પંજાબ, ખૈબર પખ્તૂન ખ્વાહ, કશ્મીર, બલૂચિસ્તાન ઔર ફિર હિન્દ, બંગ્લાદેશ, અરબ ઈમારાત, સીલંકા, બરતાનિયા, ઓસ્ટ્રેલિયા, કોરિયા જૈસે મુમાલિક મેં મદની કામોં કી મદની બહારેં લુટા રહી હૈ બલ્કિ **الْحَدِيثُ لِلَّهِ عَزَّوَجَلَّ** ઈસ વક્ત તક દા'વતે ઈસ્લામી કા મદની પૈગામ દુન્યા કે કમો બેશ 200 મુમાલિક તક પહુંચ ચુકા હૈ.

अल्लाह કરમ ઐસા કરે તુઝ પે જહાં મેં
એ દા'વતે ઈસ્લામી તેરી ધૂમ મચી હો ⁽¹⁾

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

1વસાઈલે બખ્શિશ (મુરમ્મમ), સ. 315

દા'વતે ઇસ્લામી કી તન્જીમી તરકીબ

દા'વતે ઇસ્લામી કી તન્જીમી તરકીબ, જૈલી હલ્કે સે શુરૂઅ હો કર મર્કઝી મજલિસે શૂરા તક હૈ. શૈખે તરીકત, અમીરે અહલ્લે સુન્નત **دَامَتْ بِرُكَاثِهِمُ الْعَالِيَه** ઇસ કે બાની હૈં.

દા'વતે ઇસ્લામી કી આલીશાન ઇમારત મેં જૈલી હલ્કા ઇસ કી બુન્યાદ ઓર મર્કઝી મજલિસે શૂરા છત કી હૈસિયત રખતી હૈ. દા'વતે ઇસ્લામી કી મઝબૂતી મેં અગર્યે ઇસ કે હર શો'બે કા કિરદાર અપની જગહ અહમ્મિયત કા હામિલ હૈ, મગર ઇસ હકીકત કો હર આમો ખાસ જાનતા હૈ કિ ઇમારત કી મઝબૂતી, બુન્યાદ કી મઝબૂતી પર મુન્હસિર હૈ. યુનાન્ચે, બિલ્કુલ વાઝેહ હૈ કિ દા'વતે ઇસ્લામી મેં જૈલી હલ્કે કી અહમ્મિયત કિસ કદર હૈ ! જિસ કદર જૈલી હલ્કા મઝબૂત હોગા, ઉસી કદર દા'વતે ઇસ્લામી મઝબૂત ઓર તરકકી કે મઝીદ ઝીને ચઢતી ચલી જાએગી ઓર જૈલી હલ્કે કી મઝબૂતી, જૈલી હલ્કે મેં 12 મદની કામોં કી મઝબૂતી મેં હૈ.

જૈલી હલ્કા કિસે કહતે હૈં ?

હર મસ્જિદ ઓર ઉસ કે અતરાફ કી આબાદી, મસલન રિહાઈશી મકાનાત, બાઝાર (Market), સ્કૂલ (School), કોલેજ (Collage), સરકારી વ સિવિલ ઇદારે (Government and Civil Organizations) વગૈરા કો તન્જીમી તૌર પર જૈલી હલ્કા કરાર દિયા જાતા હૈ. બા'ઝ ઓકાત (Some times) દા'વતે ઇસ્લામી કી

મુતઅલ્લિકા મુશાવરત કે નિગરાન કિસી આબાદી યા ઇદારે વગેરા કી અહમ્મિયત કે પેશે નઝર ઉસે અલગ સે ભી ઝૈલી હલકા બના દેતે હૈં.

ઝૈલી હલકા મુશાવરત : ઝૈલી હલકે મેં દર્જે ઝૈલ 3 ઝિમ્મેદારાન પર મુશ્તમિલ ઝૈલી હલકા મુશાવરત બનાઈ જાતી હૈ.

- (1) નિગરાન ઝૈલી હલકા મુશાવરત
- (2) ઝૈલી ઝિમ્મેદાર મદની કાફિલા
- (3) ઝૈલી ઝિમ્મેદાર મદની ઇન્આમાત

મદીના : બા'ઝ ઝૈલી હલકોં મેં દા'વતે ઇસ્લામી કે દીગર શો'બાજાત કે ઝૈલી ઝિમ્મેદારાન ભી અપને અપને શો'બાજાત ઓર મજલિસ કે તૈ કદા મદની ફૂલોં કે મુતાબિક મદની કામ કરતે હૈં, મગર વોહ સબ ભી નિગરાને ઝૈલી હલકા મુશાવરત કે તહ્ત હી હોતે હૈં.

ઝૈલી હલકે કા મર્કઝ

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો! તબ્લીગે કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઇસ્લામી કો દૂસરે લફઝોં મેં મસ્જિદ ભરો તહરીક ભી કહતે હૈં. ક્યૂંકિ દા'વતે ઇસ્લામી કા હર મદની કામ મસ્જિદોં કો આબાદ કરને સે મુતઅલ્લિક હૈ, યેહી વજહ હૈ કિ ઝૈલી હલકે કે તમામ મદની કામોં કા મર્કઝ (Centre) ભી મસ્જિદ હી કો કરાર દિયા ગયા, ક્યૂંકિ શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત **دَامَتُ بَرَكَاتِهِمُ الْعَالِيَةِ** કી ખ્વાહિશ હૈ કિ **اَللّٰهُمَّ** કે ઘર યા'ની મસાજિદ આબાદ હો જાએં ઓર ઉન કી રૌનકેં પલટ

આએ, મુસલમાન એક બાર ફિર મસાજિદ કી તરફ માઈલ હો જાએ, યકીનન મસાજિદ કી રૌનક, રંગો રોગન (Colour), કાલીન (Caret), લાઈટ (Light) વગૈરા સે નહીં બલકિ નમાઝિયોં ઓર મો'તકિફીન સે હૈ, તિલાવત ઓર ઝિક કરને વાલોં સે હૈ, સુન્નતેં સીખને ઓર સિખાને વાલોં સે હૈ. કિતને ખુશ નસીબ હેં વોહ ઈસ્લામી ભાઈ જો નમાઝ વ તિલાવત, દર્સો બયાન, ઝિકો ના'ત વગૈરા કે ઝરીએ મસાજિદ કી રૌનક બઢાતે હેં.

હો જાએ મૌલા મસ્જિદેં આબાદ સબ કી સબ
સબ કો નમાઝી દે બના યા રબ્બે મુસ્તફા (1)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

મસાજિદ કી આબાદકારી કી અહમિયત

મસાજિદ કો આબાદ કરને કે મુતઅલ્લિક સૂરએ તૌબહ મેં ઈરશાદ હોતા હૈ :

اتَّمَايَعْمُرْ مَسْجِدَ اللَّهِ مِنْ أَمْنٍ
بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ (پ ۱۰، التوبة: ۱۸)

તર્જમએ કન્ઝુલ ઈમાન : **અલ્લાહ**
કી મસ્જિદેં વોહી આબાદ કરતે હેં
જો **અલ્લાહ** ઓર કિયામત પર
ઈમાન લાતે.

સદરુલ અફાઝિલ, હઝરતે અલ્લામા મૌલાના મુફ્તી સયિદ મુહમ્મદ નઈમુદ્દીન મુરાદાબાદી **عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْهَادِي** તફ્સીરે ખઝાઈનુલ ઈરફાન મેં ફરમાતે હેં : ઈસ આયત મેં યેહ બયાન કિયા

1વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 131

ગયા કિ મસ્જિદોં કે આબાદ કરને કે મુસ્તહિક મોમિનીન હેં. મસ્જિદોં કે આબાદ કરને મેં યેહ ઉમૂર ભી દાખિલ હેં : ઝાડૂ દેના, સફાઈ કરના, રૌશની કરના ઓર મસ્જિદોં કો દુન્યા કી બાતોં સે ઓર ઐસી ચીજોં સે મહફૂઝ રખના જિન કે લિયે વોહ નહીં બનાઈ ગઈ, મસ્જિદેં ઇબાદત કરને ઓર ઝિક કરને કે લિયે બનાઈ ગઈ હેં ઓર ઇલ્મ કા દર્સ ભી ઝિક મેં દાખિલ હૈ. (1)

દા'વતે ઇસ્લામી મસ્જિદ ભરો તહરીક હૈ મગર કેસે ?

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો ! **اَلْحَمْدُ لِلّٰهِ عَلَيْهِ** ઝૈલી હલકે કે 12 મદની કામોં કા મેહવર મસ્જિદ કી આબાદકારી હી હૈ.

મસલન સદાએ મદીના લગા કર નમાઝે ફજ કે લિયે લોગોં કો જગાના, તાકિ વોહ બા જમાઅત નમાઝે ફજ અદા કરને કી સઆદત હાસિલ કરે, ઇસ કે બા'દ મદની હલકે મેં શિર્કત ફરમા કર કુરઆન ફેહમી કી બરકતેં લૂટેં ઓર જબ રાત કો અપને કામ કાજ સે ફારિગ હો કર ઘર વાપસ આએં તો નમાઝે ઇશા બા જમાઅત મસ્જિદ મેં અદા કરને કે બા'દ મદ્રસતુલ મદીના બાલિગાન મેં કુરઆને કરીમ પઢેં યા પઢાએં. જો મસાજિદ મેં આતે હેં ઉન્હેં ઝેવરે ઇલ્મ સે આરાસ્તા કરને કે લિયે મસ્જિદ દર્સ કા એહતિમામ કરેં ઓર જો નહીં આતે ઉન કે પાસ જા કર ઉન્હેં ચૌક દર્સ યા અલાકાઈ દૌરા બરાએ નેકી કી દા'વત કે ઝરીએ મસાજિદ મેં આને કી તરગીબ

1 ખઝાઈનુલ ઇરફાન, પારહ 10, અતૌબહ, તહ્તુલ આયત : 18, હાશિયા નમ્બર 41, સ. 357

દિલાએ. હફતે મેં એક દિન સુન્નતોં સીખને સિખાને કે લિયે હફતાવાર ઈજતિમાઅ કે મૌકઅ પર ફિર મસ્જિદ મેં જમ્મ હોં ઓર ફિર ભી અગર કુછ લોગ કિસી વજહ સે ન આ સકેં તો કિસી મુનાસિબ જગહ (ખારિજે મસ્જિદ) કી તરકીબ બના કર હફતાવાર મદની હલકા યા ફિર મદની મુઝાકરોં કે ઝરીએ ઈન કી મદની તરબિચ્ત કરેં. સુન્નતોં ભરે બયાનાત ઓર મદની મુઝાકરોં કી બરકત સે બહુત જલ્દ ઈન કે દિલોં મેં ભી મસાજિદ કી મહબ્બત પેદા હો જાએગી ઓર યેહ મસાજિદ મેં આને લગેંગે. **إِنْ شَاءَ اللَّهُ تَعَالَى**

હમ જિસ ભી મદની કામ પર ગૌર કરેં વોહ મસ્જિદ કી આબાદકારી કે ઝરાએઅ મેં સે નઝર આએગા. અમીરે અહલે સુન્નત (**دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ**) કે બતાએ હુવે તરીકોં કે મુતાબિક મુબલ્લિગીન કા મદની કામોં કે ઝરીએ મુસલમાનોં કો નેકી કી દા'વત દેના ઓર મસાજિદ કો આબાદ કરને કી કોશિશ કરના અગર બારગાહે ખુદાવન્દી મેં મકબૂલ હો ગયા તો **اللَّهُ عَزَّوَجَلَّ** કી રહમત સે ક્યા બઈદ કિ હમારા કરીમ ખાલિક **عَزَّوَجَلَّ** હમેં અપને મહબૂબ ઓર પ્યારે બન્દોં મેં શામિલ ફરમા લે. ચુનાન્ચે,

ઝેલ મેં દો ફરામૈને મુસ્તફા **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** પઢિયે ઓર મદની કામોં કી પુખ્તા નિચ્ત કીજિયે :

﴿1﴾  જો મસ્જિદ સે મહબ્બત કરતા હે **اللَّهُ عَزَّوَجَلَّ** (સ સે મહબ્બત કરતા હે. (1))

﴿2﴾ ✨ जो सुबह को या शाम को मस्जिद में गया **اَعْرَضَ** **عَزَّوَجَلَّ** उस की जन्नत में भेजमानी (दा'वत) इरमाओगा. (1)

दा'वते इस्लामी का अेक मदनी काम यौंमे ता'तील अे'तिकाइ और दूसरा मदनी काइला भी है. येह दोनों काम भी मस्जिद से मुतअद्विक हैं क्यूंकि अे'तिकाइ भी मस्जिद में होता है और मदनी काइला भी मस्जिद ही में ठहरता है, बल्कि मप्सूस दिनों तक मदनी काइले के शुरका इल्मे दीन सींभने सिंभाने की निथ्यत से रात दिन रब तबारक व तआला के घर में ठहरे रहते हैं, युनान्हे, जो लोग अपने रब तबारक व तआला की बारगाह में यूं ठहर जाते हैं उन के मुतअद्विक अेक रिवायत में है कि **اَعْرَضَ** **عَزَّوَجَلَّ** के मा'सूम इरिशते उन लोगों के हम नशीन होते हैं जो मसाजिद में पडे रहते हैं, अगर येह लोग कभी मस्जिद से गाँठब हो जाअें तो इरिशते इन्हें तलाश करते हैं और अगर बीमार हो जाअें तो इन की इयादत करते हैं और अगर इन को कोई ज़रुरत पेश आ जाअे तो इन की मदद भी करते हैं. (2)

سُبْحَانَ اللَّهِ عَزَّوَجَلَّ मस्जिदें आबाद करने वाले न सिर्फ़ डेरों सवाब लूटते हैं, बल्कि मस्जिद आबाद करने की बरकत से इरिशतों की मदद भी उन्हें हासिल होती है, उन की तकावीइ व परेशानियां दूर और हाज्जत पूरी होती हैं.

1]مسلم، كتاب المساجد... الخ، باب المشى الى الصلاة... الخ، ص 233، حديث: 229

2]مستدرک، كتاب التفسیر، ان للمساجد اوتادا... الخ، 3/122، حديث: 3559 مفهوماً

હો જાએં મૌલા મસ્જિદેં આબાદ સબ કી સબ
સબ કો નમાઝી દે બના યા રબ્બે મુસ્તફા (1)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો! **اَلْحَمْدُ لِلّٰهِ** દા'વતે ઇસ્લામી કે મદની માહોલ કી બરકત સે ચૂંકિ કઈ મસાજિદ કે તાલે ખુલે તો કઈ મસાજિદ મેં પન્જ વક્તા બા જમાઅત નમાઝ શુરૂઅ હુઈ ઔર કઈ મસાજિદ જામેઅ મસ્જિદ મેં તબદીલ હુઈ, યા'ની વહાં નમાઝે જુમુઆ કી તરકીબ શુરૂઅ હુઈ, લિહાઝા અહલે સુન્નત કી મસાજિદ કો આબાદ કરને કે લિયે ઝૈલી હલકે કે 12 મદની કામ ઇન્તિહાઈ અહમ્મિયત કે હામિલ હેં, ઇન 12 મદની કામોં કી બરકત સે **اِنْ شَاءَ اللَّهُ** અહલે સુન્નત કી મસાજિદ મેં મદની બહારેં આ જાએંગી. આઈયે દેખતે હેં કિ યેહ 12 મદની કામ ક્યા હેં? ઔર હમ ને કિસ તરહ કરને હેં ઔર ઇન મેં દીગર ઇસ્લામી ભાઈયોં કો કિસ તરહ શામિલ કરના હૈ?

બારહ મદની કામોં કી મુખ્તસર વઝાહત

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો! તબ્લીગે કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઇસ્લામી સે વાબસ્તા હર ઇસ્લામી ભાઈ કા મદની મક્સદ યેહ હૈ કિ મુઝે અપની ઔર સારી દુન્યા કે લોગોં કી ઇસ્લાહ કી કોશિશ કરની હૈ. **اِنْ شَاءَ اللَّهُ**

1વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 131

યુનાન્યે, ઈસ મદની મક્સદ કે હુસૂલ કે લિયે દા'વતે ઈસ્લામી કે મદની મર્કઝ ને ઝૈલી હલકે કે જો 12 મદની કામ દિયે હેં, દિનોં કે એ'તિબાર સે અગર ઈન કા જાઈઝા લિયા જાએ તો ઈન કી તરતીબ કુછ યૂં બનતી હૈ :

રોઝાના કે પાંચ મદની કામ :

- | | |
|-----------------|----------------------------|
| ﴿1﴾ સદાએ મદીના | ﴿2﴾ બા'દે ફજા મદની હલકા |
| ﴿3﴾ મસ્જિદ દર્સ | ﴿4﴾ મદ્રસતુલ મદીના બાલિગાન |
| ﴿5﴾ ચૌક દર્સ | |

હફતાવાર પાંચ મદની કામ :

- | | |
|-------------------------------------|-------------------------|
| ﴿6﴾ હફતાવાર ઈજતિમાઅ | ﴿7﴾ ચૌમે તા'તીલ એ'તિકાફ |
| ﴿8﴾ હફતાવાર મદની મુઝાકરા | ﴿9﴾ હફતાવાર મદની હલકા |
| ﴿10﴾ અલાકાઈ દૌરા બરાએ નેકી કી દા'વત | |

માહાના દો મદની કામ :

- | | |
|------------------|-------------------|
| ﴿11﴾ મદની કાફિલા | ﴿12﴾ મદની ઈન્આમાત |
|------------------|-------------------|
- આઈયે ! ઈન તમામ મદની કામોં કા એક મુખ્તસર જાઈઝા લેતે હેં :

રોઝાના કે પાંચ મદની કામ

﴿1﴾ સદાએ મદીના

(હદઃ : ફી ઝૈલી હલકા કમ અઝ કમ ચાર ઈસ્લામી ભાઈ)

તબ્લીગે કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે મદની માહોલ મેં નમાઝે ફજા કે લિયે મુસલમાનોં કો જગાના સદાએ મદીના કહલાતા હૈ ઔર યેહ સુન્નત

से साबित है. जैसा कि उजरते सय्यिदुना अबू बकरु (उजरते सय्यिदुना नकीअ बिन हारिस सकई) **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** इरमाते हैं : में सरकारे मदीना, राहते कल्लो सीना **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** के साथ नमाजे इज्ज के लिये निकला तो आप **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** सोते हुवे जिस शप्स पर भी गुजरते उसे नमाज के लिये आवाज देते या पाँउ मुबारक से हिलाते. (1)

शैभे तरीकत, अभीरे अहले सुन्नत **دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ** ईजाने सुन्नत (जिल्द अव्वल) में येह रिवायत नकल करने के बा'द इरमाते हैं : जो पुश नसीब सदाअे मदीना लगाते हैं **أَلْحَمْدُ لِلَّهِ عَلَيْهِ** अदाअे सुन्नत का सवाब पाते हैं. याद रहे ! पाँउ से हिलाने की सभ को ईज्जत नही. सिई वोह बुजुर्ग पाँउ से हिला सकते हैं कि जिस से सोने वाले की हिल आजारी न होती हो. हां अगर कोई मानेअे शरई न हो तो अपने हाथों से पाँउ दबा कर जगाने में हरज नही. यकीनन हमारे भीठे भीठे आका, मदीने वाले मुस्तफ़ा **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** अगर अपने किसी गुलाम को मुबारक पाँउ से हिला दें तो उस के सोअे नसीब जगा दें और किसी पुश भप्त के सर, आंभों या सीने पर अपना मुबारक कदम रभ दें तो पुदा की कसम ! कौनैन का यैन भप्श दें.

अेक ठोकर में उहुद का जलजला जाता रहा
रभती हैं कितना वकार **अल्लाहु अकबर** अेडियां

..... [] ابو داود، كتاب الصلاة، باب الاضطجاع بعدها، ص ۲۰۸، حديث: ۱۲۶۴

યેહ દિલ યેહ જિગર યેહ આંખેં યેહ સર હેં
જિધર યાહો રખો કદમ જાને આલમ (1)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો ! સદાએ મદીના લગાના (યા'ની નમાઝે ફજા કે લિયે જગાના) ઇસ કદર પ્યારી સુન્નત હે કિ ખુલફાએ રાશિદીન મેં સે હઝરતે સય્યિદુના ઉમર ફારૂક ઓર હઝરતે સય્યિદુના અલિય્યુલ મુર્તઝા (رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا) ને યેહ સુન્નત અદા કરતે હુવે અપની જાન જાને આફરીન કે સિપુર્દ કી. જૈસા કિ દા'વતે ઇસ્લામી કે ઇશાઅતી ઇદારે મક્તબતુલ મદીના કી મતબૂઆ 864 સફહાત પર મુશ્તમિલ કિતાબ ફૈઝાને ફારૂકે આ'ઝમ (જિલ્દ અવ્વલ) સફહા 757 પર હૈ : બા'ઝ રિવાયાત મેં હૈ કિ (અમીરુલ મોમિનીન હઝરતે) સય્યિદુના ઉમર ફારૂકે આ'ઝમ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ અપને ઘર સે જબ (ભી) નમાઝે ફજા કે લિયે નિકલતે તો સદાએ મદીના લગાતે હુવે નિકલતે, યા'ની રાસ્તે મેં લોગોં કો નમાઝ કે લિયે જગાતે હુવે આતે, અબૂ લુઅ લુઅ રાસ્તે મેં હી છુપા ઓર ઉસ ને મૌકઅ દેખ કર આપ પર ખન્જર કે તીન કાતિલાના વાર કર દિયે, જો મોહલિક સાબિત હુવે. (2)

ઇસી તરહ અમીરુલ મોમિનીન હઝરતે સય્યિદુના અલિય્યુલ મુર્તઝા مُحَمَّدٌ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا કી શહાદત કા વાકિઆ બયાન કરતે હુવે ઇમામ જલાલુદ્દીન સુયૂતી શાફેઈ عَلَيْهِ رَحْمَةُ اللهِ الْكَافِي ફરમાતે હેં કિ :

1] ફૈઝાને સુન્નત, ફૈઝાને બિસ્મિલ્લાહ, 1/38

2] طبقات كبرى، ذكر استخلاف عمر، 3/ 213

મુઅઝ્ઝિઝન ને આ કર અમીરુલ મોમિનીન હઝરતે સય્યિદુના અલિય્યુલ મુર્તાઝા **كَرَّمَ اللهُ تَعَالَى وَجْهَهُ الْكَرِيم** કો વક્તે નમાઝ કી ઈત્તિલાઅ દી, તો આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** નમાઝે ફજા પઢાને કે લિયે ઘર સે ચલે, રાસ્તે ભર લોગોં કો નમાઝ કે લિયે આવાઝ લગા કર જગાતે જા રહે થે કિ ઈબ્ને મુલ્જમ ખબીસ ને આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** પર અયાનક તલ્વાર કા ભરપૂર વાર કિયા જિસ સે આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** શદીદ ઝખ્મી હો ગએ ઓર બા'દ મેં ઝખ્મોં કી તાબ ન લાતે હુવે જામે શહાદત નોશ ફરમા ગએ. (1)

اللَّهُ **عَزَّوَجَلَّ** કી ઉન પર રહમત હો ઓર ઉન કે સદકે હમારી બે હિસાબ મગફિરત હો. **أَمِينٌ بِجَاهِ النَّبِيِّ الْأَمِينِ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ**

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

સદાએ મદીના કે ચઢ મદની ફૂલ

﴿1﴾ **صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ** સદાએ મદીના શૈખે તરીકત, અમીરે અહલે સુન્નાત **دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ** કે ના'તિયા કલામ વસાઈલે બખ્શિશ (મુરમ્મમ) કે સફહા 665 કે મુતાબિક હી લગાએ, ક્યૂંકિ **اللَّهُ** **عَزَّوَجَلَّ** કે વલી કી નિગાહ ઓર દુઆ કે સાથ સાથ તહરીર મેં ભી અસર હોતા હે.

﴿2﴾ **صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ** સદાએ મદીના કે લિયે મેગાફોન (Megaphone) કા ઈસ્તિ'માલ ન કરેં.

﴿3﴾ **صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ** ઈસ્લામી ભાઈયોં કી તા'દાદ ઝિયાદા હોને કી સૂરત મેં મુખ્તલિફ સમતોં મેં દો-દો ઈસ્લામી ભાઈ ભેજ દિયે જાએં.

..... 112 ماخوذاً
فصل في مبايعة علي بالخلافة... الخ، ص 112 ماخوذاً

«4» ✎ અગર કોઈ ઈસ્લામી ભાઈ ન આએ તો અકેલે હી સદાએ મદીના કી સઆદત હાસિલ કરેં.

«5» ✎ સદાએ મદીના અઝાને ફજા કે બા'દ શુરૂઅ કી જાએ.

«6» ✎ જહાં કહીં જાનવર વગૈરા બન્ધે હોં વહાં આવાઝ કદરે કમ હોની ચાહિયે.

«7» ✎ સદાએ મદીના સે ફારિગ હો કર મસ્જિદ મેં ઈતની દેર પહલે પહુંચેં કિ સુન્નતે કબ્લયા ઈકામત સે કબ્લ ઓર તકબીરે ઊલા વ સફે અવ્વલ પા સકેં.

«8» ✎ સદાએ મદીના સે કબ્લ હી ઈસ્તિન્જા ઓર વુઝૂ સે ફારિગ હો લેં.

«9» ✎ ફજા મેં ઉઠાને કે લિયે તરગીબ ઓર નામ લિખને કી તરકીબ ભી કી જાએ.

«10» ✎ જો ઈસ્લામી ભાઈ નામ લિખવાએં ઉન કે દરવાઝે પર દસ્તક દેં યા બેલ (Bell) ભી બજાએં.

«11» ✎ કિસી ભી મો'તરિઝ યા ઝગડાલૂ સે ન ઝગડેં, ન ઉલઝેં.

«12» ✎ અઝાને ફજા સે ઈતની દેર પહલે ઉઠેં કિ આપ બ આસાની ફજા કા વક્ત શુરૂઅ હોને સે કબ્લ ઈસ્તિન્જા વ વુઝૂ ઓર તહજજુદ સે ફારિગ હો સકેં.

«13» ✎ વક્તે મુનાસિબ પર ઉઠને કે લિયે અલાર્મ (Alarm), ઘર કે કિસી બડે, ચૌકીદાર યા કિસી ઈસ્લામી ભાઈ કો જગાને કા કહને કી તરકીબેં કરેં. શજરએ કાદિરિયા રઝવિયા ઝિયાઈયા અત્તારિયા મેં સફહા નમ્બર 32 પર હૈ કિ સૂરએ

કહ્ફ કી આખિરી ચાર આયતેં યા'ની **إِنَّ الْأَرْيَافِينَ آمَنُوا** સે ખત્મે સૂરહ તક. રાત મેં યા સુબહ જિસ વક્ત જાગને કી નિચ્યત સે પઢેં, આંખ ખુલેગી. **إِنْ شَاءَ اللَّهُ تَعَالَى**

﴿14﴾ **☞** અપને ઘર કે અફરાદ નીઝ કામ કાજ કે સિલસિલે મેં ફલેટ્સ વગૈરા મેં રિહાઈશ પઝીર ઈસ્લામી ભાઈ અપને સાથ રહને વાલોં ઈસી તરહ કોલેજ, યૂનિવર્સિટી મેં દૌરાને તા'લીમ હોસ્ટેલ વગૈરા મેં કિયામ પઝીર ઈસ્લામી ભાઈ સાથી તલબા કો ભી નર્મી ઔર મહબ્બત કે સાથ નમાઝે ફજ્ર કે લિયે બેદાર કરેં.

﴿15﴾ **☞** જિન અલાકોં મેં કિસી વજહ સે બા આવાઝે બુલન્દ સદાએ મદીના લગાના ઔર દરવાઝોં પર દસ્તક દે કર જગાના મુમકિન ન હો, વહાં પર ભી ફોન યા ઈન્ટરનેટ કોલ કે ઝરીએ ઈસ્લામી ભાઈયોં કો નમાઝે ફજ્ર કે લિયે જગાએં.

ગલી મેં સદાએ મદીના કા તરીકા

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

પઠ કર દુરુદો સલામ કે ઝૈલ મેં દિયે હુવે સીગે પઠ કર ઈસ કે બા'દ વાલા મઝમૂન દોહરાતે રહિયે :

وَعَلَىٰ إِلَيْكَ وَأَصْحَابِكَ يَا حَبِيبَ اللَّهِ
وَعَلَىٰ إِلَيْكَ وَأَصْحَابِكَ يَا نُوْرَ اللَّهِ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ઔર ઈસ્લામી બહનો ! ફજ્ર કી નમાઝ કા વક્ત હો ગયા હૈ. સોને સે નમાઝ બેહતર હૈ. જલ્દી જલ્દી ઉઠિયે ઔર નમાઝ કી તય્યારી કીજિયે. **اَللّٰهُمَّ** આપ કો બાર બાર હજ નસીબ કરે ઔર બાર બાર મીઠા મદીના દિખાએ.

(મોકએ કી મુનાસબત સે નીચે દી હુઈ નઝ્મ મેં સે મુન્તાખબ અશ્આર ભી પઢિયે)

(રમઝાનુલ મુબારક મેં સહરી કે લિયે ઉઠાએં તો તહજજુદ કી ભી તરગીબ દિલાએં)

ફજ કા વક્ત હો ગયા ઉઠ્ઠો ! એ ગુલામાને મુસ્તફા ઉઠ્ઠો !
 જાગો જાગો એ ભાઈયો, બહનો ! છોડ દો અબ તો બિસ્તરા ઉઠ્ઠો !
 તુમ કો હજ કી ખુદા સઆદત દે જલ્વા દેખો મદીને કા ઉઠ્ઠો !
 ઉઠ્ઠો જિકે ખુદા કરો ઉઠ કર દિલ સે લો નામે મુસ્તફા ઉઠ્ઠો !
 ફજ કી હો ચુકી અઝાનેં વક્ત હો ગયા હેં નમાઝ કા ઉઠ્ઠો !
 ભાઈયો ! ઉઠ કર અબ વુઝૂ કર લો ઓર ચલો ખાનએ ખુદા ઉઠ્ઠો !
 નીંદ સે તો નમાઝ બેહતર હેં ! અબ ન મુતલક ભી લેટના ઉઠ્ઠો !
 ઉઠ ચુકો અબ ખડે ભી હો જાઓ ! આંખ શૈતાં ન દે લગા ઉઠ્ઠો !
 જાગો જાગો નમાઝ ગફલત સે કર ન બેઠો કહીં કઝા ઉઠ્ઠો !
 અબ “જો સોએ નમાઝ ખોએ” વક્ત સોને કા અબ નહીં રહા ઉઠ્ઠો !
 યાદ રખો ! નમાઝ ગર છોડી કબ્ર મેં પાઓગે સઝા ઉઠ્ઠો !
 બે નમાઝી ફંસેગા મહશર મેં હોગા નારાઝ કિબ્રિયા ઉઠ્ઠો !
 મેં “સદાએ મદીના” દેતા હૂં તુમ કો તયબા કા વાસિતા ઉઠ્ઠો !
 મેં ભિકારી નહીં હૂં દર દર કા મેં હૂં સરકાર કા ગદા ઉઠ્ઠો !
 મુઝ કો દેના ન પાઈ પૈસા તુમ ! મેં હૂં તાલિબ સવાબ કા ઉઠ્ઠો !
 તુમ કો દેતા હેં યેહ દુઆ અત્તાર ફઝલ તુમ પર કરે ખુદા ઉઠ્ઠો ! (1)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

﴿2﴾ બા'દે ફજ મદની હલકા

(હદફ : ફી ઝૈલી હલકા કમ અઝ કમ શુરકા 12 ઈસ્લામી ભાઈ)

બા'દે ફજ મદની હલકા : સે મુરાદ રોઝાના બા'દે ફજ તા ઈશરાક વ યાશત કન્જુલ ઈમાન શરીફ સે તીન આયાત, તર્જમએ

1વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 665 તા 667

કન્ઝુલ ઈમાન ઓર તફ્સીરે સિરાતુલ જિનાન / ખઝાઈનુલ ઈરફાન / નૂરુલ ઈરફાન સે દેખ કર સુનાના, ફૈઝાને સુન્નત સે તરતીબ વાર ચાર સફહાત કા દર્સ, મન્ઝૂમ શજરએ કાદિરિયા રઝવિયા અત્તારિયા, અવરાદો વઝાઈફ ઓર ઈજતિમાઈ ફિકે મદીના કરના (યા'ની મદની ઈન્આમાત કા રિસાલા પુર કરના) હૈ.

એ કાશ ! મુબલિગ મેં બનૂં દીને મુબીં કા
સરકાર ! કરમ અઝ પએ હસ્સાને મદીના (1)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

બા'દે ફજ મદની હલકે મેં શિકત સે તિલાવતે કુરઆને પાક, તર્જમા વ તફ્સીર, ફૈઝાને સુન્નત કે ચાર સફહાત કા દર્સ, અવરાદો વઝાઈફ, ઓલિયાએ કિરામ કે તઝકિરોં સે મા'મૂર શજરા શરીફ પઢને સુનને કી સઆદત પા કર દિન કા આગાઝ કરના કિતના બા બરકત હોગા ! ગોયા કિ બા'દે ફજ મદની હલકા ઉમૂરે ખૈર કા મજમૂઆ હૈ.

જો નમાઝે ફજ બા જમાઅત અદા કરને કે બા'દ ઝિકુલ્લાહ મેં મસરૂફ રહે, યહાં તક કિ સૂરજ બુલન્દ હો જાએ ઓર દો રકઅત પઢે, ઉસ કે લિયે તો ખાસ ફઝીલત ભી હૈ. જૈસા કિ મરવી હૈ કિ જો શખ્સ નમાઝે ફજ બા જમાઅત અદા કર કે ઝિકુલ્લાહ કરતા રહે, યહાં તક કિ આફતાબ બુલન્દ હો જાએ ફિર દો રકઅતેં પઢે તો ઉસે પૂરે હજ વ ઉમરહ કા સવાબ મિલેગા. (2) એક ઓર જગહ ઈરશાદ ફરમાયા : જો શખ્સ નમાઝે ફજ સે ફારિગ હોને કે બા'દ અપને

1 વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 364

2 તરમ્ઝી, ایواب السفر، باب ما ذكر مما يستحب من الجلوس الخ، ص 171، حديث: 587

મુસલ્લે મેં (યા'ની જહાં નમાઝ પઢી વહીં) બૈઠા રહા હતા કિ ઇશરાક કે નફલ પઢ લે, સિર્ફ ખૈર હી બોલે તો ઉસ કે ગુનાહ બખ્શ દિયે જાએંગે, અગર્યે સમન્દર કે ઝાગ સે ભી ઝિયાદા હોં. (1)

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો ! હદીસે પાક કે ઇસ હિસ્સે અપને મુસલ્લે મેં બૈઠા રહે કી વઝાહત કરતે હુવે હઝરતે સચ્ચિદુના મુલ્લા અલી કારી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْبَارِیٰ ફરમાતે હેં : યા'ની મસ્જિદ યા ઘર મેં ઇસ હાલ મેં રહે કિ ઝિક્ર યા ગૌરો ફિક્ર કરને યા ઇલ્મે દીન સીખને સિખાને યા બૈતુલ્લાહ કે તવાફ મેં મશગૂલ રહે, નીઝ સિર્ફ ખૈર હી બોલે કે બારે મેં ફરમાતે હેં : યા'ની ફજ્જા ઓર ઇશરાક કે દરમિયાન ખૈર યા'ની ભલાઈ કે સિવા કોઈ ગુફતગૂન ન કરે, ક્યૂંકિ યેહ વોહ બાત હૈ જિસ પર સવાબ મુરતબ હોતા હૈ. (2)

મદની ફૂલ : નિગરાને ઝૈલી મુશાવરત / ઝૈલી ઝિમ્મેદાર મદની ઇન્આમાત રોઝાના બા'દે ફજ્જા મદની હલ્કે કી તરકીબ ફરમાએં, નીઝ ઝૈલી મુશાવરત આજ કે મદની કામોં કે લિયે મશવરા કરે. (બા'દે ફજ્જા મદ્રસતુલ મદીના બાલિગાન કી ભી તરકીબ હો સક્તી હૈ)

صَلُّوْا عَلَی الْحَبِیْبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَی مُحَمَّدٍ

﴿3﴾ મસ્જિદ દર્સ

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત دَامَتْ بَرَكَاتُهُمْ الْعَالِيَةِ કી ચન્દ કુતુબો રસાઈલ કે ઇલાવા બાકી તમામ કુતુબો રસાઈલ બિલ ખુસૂસ

1 ابوداود، کتاب الصلاة، باب صلاة الضحی، ص 211، حدیث: 1284

2 مرقاة، کتاب الصلاة، باب صلاة الضحی، الفصل الثانی، 3/358، تحت الحدیث: 1314 ملقطاً

ફેઝાને સુન્નત સે મસ્જિદ મેં દર્સ દેને કો તન્જીમી ઇસ્તિલાહ મેં મસ્જિદ દર્સ⁽¹⁾ કહતે હેં. મસ્જિદ દર્સ ભી ફરોગે ઇલ્મે દીન કી હી એક કદી હે જિસ કે લિયે તકરીબન હર મસ્જિદ મેં રોઝાના કમ અઝ કમ એક મદની દર્સ⁽²⁾ કી તરકીબ બનાને કી કોશિશ કી જાતી હે. મસ્જિદ મેં ઇજાઝત ન હોને કી સૂરત મેં ઇન્તિઝામિયા, ખતીબો ઇમામ વ મુઅઝ્ઝિન વગૈરા કી મુખાલફત કિયે બિગૈર બાહર દર્સ દિયા જાતા હે.

સઆદત મિલે દર્સે “ફેઝાને સુન્નત”

કી રોઝાના દો મરતબા યા ઇલાહી ⁽³⁾

صَلُّوْا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

[1].....અમીરે અહલે સુન્નત ﷺ કી કુતુબો રસાઈલ સે મદની દર્સ દિયા જાએ, અલબત્તા ! બા'ઝ કુતુબો રસાઈલ સે દર્સ દેને કી ઇજાઝત નહીં, ઉન મેં સે ચન્દ એક યેહ હેં : «1» કુફિયા કલિમાત કે બારે મેં સુવાલ જવાબ «2» 28 કલિમાતે કુફ «3» ગાનોં કે 35 કુફિયા અશઆર «4» પદેં કે બારે મેં સુવાલ જવાબ «5» ચન્દે કે બારે મેં સુવાલ જવાબ «6» અકીકે કે બારે મેં સુવાલ જવાબ «7» ઇસ્તિન્જા કા તરીકા «8» નમાઝ કે અહકામ «9» ઇસ્લામી બહનોં કી નમાઝ «10» ઝિક વાલી ના'ત ખ્વાની «11» ના'ત ખ્વાં ઓર નઝરાના «12» કૌમે લૂત કી તબાહ કારિયાં «13» કપડે પાક કરને કા તરીકા મઅ નજાસતોં કા બયાન «14» રફીકુલ હરમૈન «15» રફીકુલ મો'તમિરીન «16» હલાલ તરીકે સે કમાને કે 50 મદની ફૂલ.

[2].....મદની દર્સ સે મુરાદ શૈબે તરીકત, અમીરે અહલે સુન્નત ﷺ કી ચન્દ એક કુતુબ કે ઇલાવા બાકી તમામ કુતુબો રસાઈલ સે દર્સ કી તરકીબ બનાના હે. નીઝ યાદ રખિયે કિ શૈબે તરીકત, અમીરે અહલે સુન્નત ﷺ કી કુતુબો રસાઈલ કે ઇલાવા કિસી ઓર કિતાબ સે દર્સ દેને કી મર્કઝી મજલિસે શૂરા કી તરફ સે ઇજાઝત નહીં.

[3].....વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 103

મસ્જિદ દર્સ કે ﴿21﴾ મદની ફૂલ

﴿1﴾ ﷺ ફરમાને મુસ્તફા صَلَّی اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો શાખ્સ મેરી ઉમ્મત તક કોઈ ઈસ્લામી બાત પહુંચાએ તાકિ ઉસ સે સુન્નત કાઈમ કી જાએ યા ઉસ સે બદ મઝહબી દૂર કી જાએ તો વોહ જન્નતી હે. (1)

﴿2﴾ ﷺ સરકારે મદીના صَلَّی اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ઈરશાદ ફરમાયા : “**اَللّٰهُ** તઆલા ઉસ કો તરો તાઝા રખે જો મેરી હદીસ સુને, યાદ રખે ઓર દૂસરોં તક પહુંચાએ.” (2)

﴿3﴾ ﷺ હઝરતે સય્યિદુના ઈદરીસ عَلَیْهِ السَّلَام وَالصَّلَاةُ وَالسَّلَام કે મુબારક નામ કી એક હિક્મત યેહ ભી હૈ કિ આપ **اَللّٰهُ** عَلَيْهِ السَّلَام કે અતાકદા સહીફે લોગોં કો કસરત સે સુનાયા કરતે થે. લિહાઝા આપ **اَللّٰهُ** عَلَيْهِ السَّلَام કા નામ હી ઈદરીસ (યા'ની દર્સ દેને વાલા) હો ગયા. (3)

﴿4﴾ ﷺ હુઝૂરે ગૌસે પાક **رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ** ફરમાતે હૈં : “**دَرَسْتُ الْعِلْمَ حَتَّى صِرْتُ قُطْبًا**” (યા'ની મેં ને ઈલ્મ કા દર્સ લિયા, યહાં તક કે મકામે કુતબિયત પર ફાઈઝ હો ગયા) (4)

﴿5﴾ ﷺ દર્સ દેના ભી દા'વતે ઈસ્લામી કા એક કામ હૈ. ઘર, મસ્જિદ, દુકાન, સ્કૂલ, કોલેજ, ચૌક વગેરા મેં વક્ત મુકરર કર કે દર્સ કે ઝરીએ ખૂબ સુન્નતોં કે મદની ફૂલ લુટાઈયે ઓર ઢેરોં સવાબ કમાઈયે.

﴿6﴾ ﷺ રોઝાના કમ અઝ કમ દો દર્સ દેને યા સુનને કી સઆદત હાસિલ કીજિયે. (ઈન દો મેં એક “ઘર દર્સ” ઝરૂર હો.)



1..... حلیة الاولیاء، 10/35، رقم: 13322

2..... ترمذی، ابواب العلم، باب ماجاء فی الحث... الخ، ص 222، حدیث: 2652، ملئقا

3..... تفسیر بغوی، پار 128، مریم، تحت الآية: 91/3

4..... મદની પન્જ સૂરહ, કસીદએ ગૌસિયા, સ. 264

﴿7﴾ ✎ પારહ 28 સૂરતુત્તહરીમ કી છટી આયત મેં ઈરશાદ હોતા

હે : **يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقْوُدْهَا النَّاسُ وَالْجِبَارَةُ**

(તર્જમએ કન્ઝુલ ઈમાન : ઐ ઈમાન વાલો ! અપની જાનોં
ઔર અપને ઘરવાલોં કો ઉસ આગ સે બચાઓ જિસ કે ઈંધન આદમી
ઔર પથ્થર હેં.) અપને આપ કો ઔર અપને ઘરવાલોં કો દોઝખ કી
આગ સે બચાને કા એક ઝરીઆ મદની દર્સ ભી હે.

﴿8﴾ ✎ ઝિમ્મેદાર ઘડી કા વક્ત મુકરર કર કે રોઝાના ચૌક દર્સ કા
એહતિમામ કરેં. મસલન 9 બજે મદીના ચૌક, 09:30 બજે બગદાદી
ચૌક મેં વગૈરા. છુટ્ટી વાલે દિન એક સે ઝિયાદા મકામાત પર ચૌક
દર્સ કા એહતિમામ કીજિયે, મગર હુકૂકે આમ્મા તલફ ન હોં મસલન
કિસી મુસલમાન યા જાનવર વગૈરા કા રાસ્તા ન રુકે વરના ગુનાહગાર
હોંગે. (તફ્સીલી મા'લૂમાત કે લિયે ફૈઝાને સુન્નત (જદીદ) સે “દર્સે
ફૈઝાને સુન્નત કે 22 મદની ફૂલ” મુલાહજા ફરમાએ)

﴿9﴾ ✎ દર્સ કે લિયે વોહ નમાઝ મુન્તખબ કીજિયે જિસ મેં ઝિયાદા
સે ઝિયાદા ઈસ્લામી ભાઈ શરીક હો સકેં.

﴿10﴾ ✎ દર્સ વાલી નમાઝ ઉસી મસ્જિદ કી પહલી સફ મેં તકબીરે
ઊલા કે સાથ બા જમાઅત અદા ફરમાઈયે.

﴿11﴾ ✎ મેહરાબ સે હટ કર (સેહન વગૈરા મેં) કોઈ ઐસી જગહ
દર્સ કે લિયે મખ્સૂસ કર લીજિયે જહાં દોગર નમાઝિયોં ઔર તિલાવત
કરને વાલોં કો દુશ્વારી ન હો.

﴿12﴾ ✎ નિગરાને ઝૈલી મુશાવરત કો ચાહિયે કિ અપની મસ્જિદ
મેં દો ખૈર ખ્વાહ મુકરર કરે જો દર્સ (બયાન) કે મૌકઅ પર જાને
વાલોં કો નર્મી સે રોકે ઔર સબ કો કરીબ કરીબ બિઠાએ

﴿13﴾ ✎ પર્દે મેં પર્દા ક્રિયે દો ઝાનૂ બૈઠ કર દર્સ દીજિયે. અગર સુનને વાલે ઝિયાદા હોં તો ખડે હો કર યા માઈક પર દેને મેં ભી હરજ નહીં, જબ કિ નમાઝિયોં વગૈરા કો તશવીશ ન હો.

﴿14﴾ ✎ આવાઝ ઝિયાદા બુલન્દ હો ન બિલકુલ આહિસ્તા હત્તલ ઈમકાન ઈતની આવાઝ સે દર્સ દીજિયે કિ સિર્ફ હાઝિરીન સુન સકેં. બહર સૂરત નમાઝિયોં કો તક્લીફ નહીં હોની યાહિયે.

﴿15﴾ ✎ દર્સ હમેશા ઠહર ઠહર કર ઓર ધીમે અન્દાઝ મેં દીજિયે.

﴿16﴾ ✎ જો કુછ દર્સ દેના હૈ, પહલે ઉસ કા કમ અઝ કમ એક બાર મુતાલઆ કર લીજિયે તાકિ ગલતિયાં ન હોં.

﴿17﴾ ✎ મુઅરબ અલફાઝ (યા'ની જિન લફઝોં પર ઝબર, ઝેર ઓર પેશ વગૈરા લિખા હુવા હૈ ઉન કો) એ'રાબ કે મુતાબિક હી અદા કીજિયે, ઈસ તરહ **إِنْ شَاءَ اللهُ** તલફફુઝ કી દુરુસ્ત અદાએગી કી આદત બનેગી.

﴿18﴾ ✎ હમ્દો સલાત, દુરૂદો સલામ કે ચારોં સીગે, આયતે દુરૂદ ઓર ઈખ્તિતામી આયાત વગૈરા કિસી સુન્ની આલિમ યા કારી કો ઝરૂર સુના દીજિયે. ઈસી તરહ અરબી દુઆએં વગૈરા જબ તક ઉલમાએ અહલે સુન્નત કો ન સુના લેં, અકેલે મેં અપને તૌર પર ભી ન પઢા કરેં.

﴿19﴾ ✎ દર્સ મઅ ઈખ્તિતામી દુઆ સાત મિનટ કે અન્દર અન્દર મુકમ્મલ કર લીજિયે.

﴿20﴾ ✎ હર મુબત્લિગ કો યાહિયે કિ વોહ દર્સ કા તરીકા, બા'દ કી તરગીબ ઓર ઈખ્તિતામી દુઆ ઝબાની યાદ કર લે.

﴿21﴾ ✎ દર્સ કે તરીકે મેં ઈસ્લામી બહનેં હસ્બે ઝરૂરત તરમીમ કર લેં.

हे तुज से हुआ रब्बे अकबर ! मकबूल हो “इंजाने सुन्नत”
मस्जिद मस्जिद घर घर पढ कर, ईस्लामी भाई सुनाता रहे (1)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

मस्जिद में दर्सा देने के मकासिद

भीठे भीठे ईस्लामी भाईयो ! ज कदरे जरूरत ईल्मे दीन सीपना, यूंकि हर मर्द व औरत पर फर्ज है, लिहाजा जरूरी ईल्मे दीन से इ शनास होने के लिये मदनी दर्सा अेक बहुत बडा जरीआ है, युनान्चे, दा'वते ईस्लामी के ईशाअती ईदारे मक्तबतुल मदीना की मतबूआ 696 सङ्घात पर मुशतमिल किताब नेक बनने और बनाने के तरीके सङ्घा 197 पर मस्जिद दर्सा के मकासिद कुछ यूं मजकूर हैं :

﴿1﴾ ✎ दर्सा देने का सब से बडा मकसद **अल्लाह** व रसूल ﷺ की रिआ है.

﴿2﴾ ✎ मदनी दर्सा के जरीअे शुरकाअे दर्सा और अहले महल्ला को अहले महल्लत बलिह उकीकी मा'नों में “दा'वते ईस्लामी” वाला बनाना है.

﴿3﴾ ✎ मस्जिद में मदनी दर्सा के शुरका के जरीअे उफते में अेक बार अलाकाई दौरा बराअे नेकी की दा'वत की तरकीब बनानी है.

1वसाईले बप्तिशश (मुरम्मम), स. 475

«4» ➡ મદની દર્સ મેં શુરકાએ દર્સ કો મદની ઇન્આમાત પર અમલ ઓર રોઝાના ફિકે મદીના કર કે મદની ઇન્આમાત કા રિસાલા પુર કરને કી તરગીબ દિલાની હૈ ઓર ઉન કો મદની કાફિલે મેં સફર કરને ઓર કરવાને કા ઝેહન ભી દેના હૈ.

«5» ➡ હફતાવાર ઇજતિમાઅ ઓર હફતાવાર મદની મુઝાકરે મેં પાબન્દિયે વક્ત સે અવ્વલ તા આખિર શિર્કત કે લિયે તથ્યાર કરના હૈ.

«6» ➡ મસ્જિદ કે ઇમામ સાહિબ ઓર કમેટી વાલોં કો ભી મદની કાફિલે મેં સફર પર આમાદા કરના હૈ.

«7» ➡ મસ્જિદ સત્હ પર સદાએ મદીના કી તરકીબ ભી બનાની હૈ.

«8» ➡ મસ્જિદ સત્હ પર હર રોઝ મુલાકાત કે લિયે ફજ કે બા'દ મદની હલ્કા શુરુઅ કરના હૈ ઓર મસ્જિદ કે અતરાફ મેં જો લોગ નમાઝ નહીં પઢતે ઉન્હેં નમાઝ કી તરગીબ ભી દિલાની હૈ.

«9» ➡ મસ્જિદ કે કુર્બો જવાર મેં પુરાને ઇસ્લામી ભાઈયોં મેં સે જો પહલે આતે થે અબ નહીં આતે, ઉન સે મુલાકાત કર કે ઉન્હેં મદની કાફિલોં મેં સફર કી તરગીબ દિલાની હૈ.

«10» ➡ શુરકાએ દર્સ કો “દા’વતે ઇસ્લામી” કા મુબલિગ વ મુઅલિમ બનાના હૈ.

«11» ➡ મસ્જિદ કે કરીબ ચૌક દર્સ કી તરકીબ બનાની હૈ.

«12» ➡ મસ્જિદ મેં મદ્રસતુલ મદીના બાલિગાન કા સિલસિલા શુરુઅ કરના ઓર ઇસે મઝબૂત કરના હૈ.

ઈલાહી હર મુબલ્લિગ પૈકરે ઈખ્લાસ બન જાએ
કરમ હો દા'વતે ઈસ્લામી વાલોં પર કરમ મૌલા (1)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّد

મદની દર્સ દેને કા તરીકા

તીન બાર ઈસ તરહ એ'લાન ફરમાઈયે :

“કરીબ કરીબ તશરીફ લાઈયે”

પદેં મેં પદા ક્રિયે દો જાનૂ બૈઠ કર ઈસ તરહ ઈબ્તિદા કીજિયે :

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِيْنَ
اَمَّا بَعْدُ فَاَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ ط بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ط

ઈસ કે બા'દ ઈસ તરહ દુરુદો સલામ પઢાઈયે :

અગર મસ્જિદ મેં હૈં તો ઈસ તરહ એ'તિકાફ કી નિયત
કરવાઈયે :

نَوَيْتُ سُنَّتَ الرَّعِيْكَانِ

(તર્જમા : મેં ને સુન્નત એ'તિકાફ કી નિયત કી)

ફિર ઈસ તરહ કહિયે : મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! કરીબ
કરીબ આ કર દર્સ કી તા'જીમ કી નિયત સે હો સકે તો દો જાનૂ બૈઠ

1 વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 99

જાઈયે, અગર થક જાએં તો જિસ તરહ આપ કો આસાની હો ઉસી તરહ બૈઠ કર નિગાહેં નીચી કિયે તવજજોહ કે સાથ મદની દર્સ સુનિયે કિ લા પરવાહી કે સાથ ઈધર ઉધર દેખતે હુવે, ઝમીન પર ઉંગલી સે ખેલતે હુવે, લિબાસ, બદન યા બાલોં વગૈરા કો સહલાતે હુવે સુનને સે ઈસ કી બરકતેં ઝાઈલ હોને કા અન્દેશા હૈ.

(બયાન કે આગાઝ મેં ભી ઈસી અન્દાઝ મેં તરગીબ દિલાઈયે)

યેહ કહને કે બા'દ ફૈઝાને સુન્નત વગૈરા સે દેખ કર દુરુદ શરીફ કી એક ફઝીલત બયાન કીજિયે. ફિર કહિયે :

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

જો કુછ લિખા હુવા હૈ વોહી પઠ કર સુનાઈયે. આયાત વ અરબી ઈબારાત કા સિર્ફ તર્જમા પઢિયે. કિસી ભી આયત યા હદીસ કા અપની રાએ સે હરગિઝ ખુલાસા મત કીજિયે.

દર્સ કે આખિર મેં ઈસ તરહ તરગીબ દિલાઈયે !

(હર મુબલિગ કો ચાહિયે કિ ઝબાની યાદ કર લે ઓર દર્સો બયાન કે આખિર મેં બિલા કમી વ બેશી ઈસી તરહ તરગીબ દિલાયા કરે)

اَلْحَمْدُ لِلَّهِ عَلَيْهِ التَّوَكَّلُ تબલીગે કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર

સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે મહકે મહકે મદની માહોલ મેં બ કસરત સુન્નતેં સીખી ઓર સિખાઈ જાતી હૈં. (અપને યહાં કે હફતાવાર ઈજતિમાઅ કા એ'લાન ઈસ તરહ કીજિયે મસલન બાબુલ

મદીના કરાચી વાલે કહે) હર જુમા'રાત કો ફેઝાને મદીના મહલ્લા સૌદા ગરાન પુરાની સબ્જી મન્ડી મેં મગરિબ કી નમાઝ કે બા'દ હોને વાલે સુન્નતોં ભરે ઈજતિમાઅ મેં રિઝાએ ઈલાહી કે લિયે અચ્છી અચ્છી નિયતોં કે સાથ સારી રાત ગુઝારને કી મદની ઈલતિજા હૈ. આશિકાને રસૂલ કે મદની કાફિલોં મેં સુન્નતોં કી તરબિયત કે લિયે સફર ઔર રોઝાના ફિકે મદીના કે ઝરીએ મદની ઈન્આમાત કા રિસાલા પુર કર કે હર મદની માહ કી પહલી તારીખ મેં અપને યહાં કે ઝિમ્મેદાર કો જમ્મ કરવાને કા મા'બૂલ બના લીજિયે. **إِنْ شَاءَ اللَّهُ تَعَالَى** ઈસ કી બરકત સે પાબન્દે સુન્નત બનને, ગુનાહોં સે નફરત કરને ઔર ઈમાન કી હિફાઝત કે લિયે કુઢને કા ઝેહ્ન બનેગા. હર ઈસ્લામી ભાઈ અપના યેહ મદની ઝેહ્ન બનાએ કિ મુઝે અપની ઔર સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કરની હૈ. **إِنْ شَاءَ اللَّهُ تَعَالَى**

અપની ઈસ્લાહ કી કોશિશ કે લિયે મદની ઈન્આમાત પર અમલ ઔર સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કે લિયે મદની કાફિલોં મેં સફર કરના હૈ. **إِنْ شَاءَ اللَّهُ تَعَالَى**

अल्लाह કરમ ઐસા કરે તુઝ પે જહાં મેં
 ઐ દા'વતે ઈસ્લામી તેરી ધૂમ મચી હો (1)

اٰمِيْنَ بِجَاهِ النَّبِيِّ الْاَمِيْنَ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

1 વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 315

आपिर में पुशूअ व पुजूअ (पुशूअ या'नी बदन की आजिजी और पुजूअ या'नी दिलो दिमाग की छाजिरी) के साथ दुआ में हाथ उठाने के आदाब बजा लाते हुवे बिला कमी व बेशी ँस तरह दुआ मांगिये :

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِيْنَ ط

या रब्बे मुस्तफ़ा **عَزَّوَجَلَّ** !

ब तुझे ले मुस्तफ़ा **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ**

हमारी, हमारे मां-बाप की और सारी उम्मत की मगफ़िरत फ़रमा. या **اَللّٰهُ** **عَزَّوَجَلَّ** ! दर्स की गलतियां और तमाम गुनाह मुआफ़ फ़रमा. नेक अमल का जज़्बा दे, हमें परहेजगार और मां-बाप का फ़रमां बरदार बना. या **اَللّٰهُ** **عَزَّوَجَلَّ** ! हमें अपना और अपने मदनी हबीब **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** का मुफ़िलस आशिक बना. हमें गुनाहों की बीमारियों से शिफ़ा अता फ़रमा. या **اَللّٰهُ** **عَزَّوَجَلَّ** ! हमें मदनी ँन्आमात पर अमल करने, मदनी काइलों में सफ़र करने और ँनफ़िरादी कोशिश के ज़रीअे दूसरों को भी मदनी कामों की तरगीब दिवाने का जज़्बा अता फ़रमा. या **اَلलّٰهُ** **عَزَّوَجَلَّ** ! हर मुसलमान को बीमारियों, कर्ज़ दारियों, बे रोज़गारियों, बे औलादियों, बे ज़ा मुकदमे बाजियों और तरह तरह की परेशानियों से नज़ात अता फ़रमा. या **اَللّٰهُ** **عَزَّوَجَلَّ** !

दर्स की कमाई पाने के लिये (जड़े जड़े नहीं बटिक) बैठ कर अन्दा पेशानी के साथ लोगों से मुलाकात कीजिये, यन्द् नअे ईस्लामी भाईयों को अपने करीब बिटा लीजिये और ईनफ़िरादी कोशिश के जरीअे उन्हें मदनी ईन्आमात और मदनी काफ़िलों की बरकतें समजाईये. (बैठ कर मिलने में हिक्मत येह है कि कुछ न कुछ ईस्लामी भाई हो सकता है आप के साथ बैठे रहें वरना जड़े जड़े मिलने वाले उभूमन यल पउते हैं, यूं ईनफ़िरादी कोशिश की सआदत से मदरूमि हो सकती है)

तुम्हें अै मुबद्विग ! येह मेरी हुआ है
 किये जाओ ते तुम तरक्की का जीना (1)

हुआअे अतार : या **اَللّٰهُ** ! मुजे और पाबन्दी के साथ रोजाना कम अज कम हो मदनी दर्स अेक घर में और दूसरा मस्जिद, यौक या स्कूल वगैरा में देने और सुनने वाले की मगफ़िरत फ़रमा और हमें हुस्ने अप्लाक का पैकर बना. *اَمِيْنَ بِجَاهِ النَّبِيِّ الْاَمِيْنَ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ*

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٌ

﴿4﴾ मद्रसतुल मदीना बालिगान

(हदइ : ई जैली हल्का कम अज कम अेक मद्रसा, शुरका :

19 ईस्लामी भाई, दौरानिया 41 मिनट)

दा'वते ईस्लामी के मदनी माहोल में रोजाना हर जैली हल्के में बालिग ईस्लामी भाईयों को हुरुस्त मभारिज के साथ कुरआने करीम पढाने का सिलसिला होता है, जिसे मद्रसतुल मदीना बालिगान कहते हैं.

I वसाईले बफ़िश (मुरम्मम), स. 371

મીઠે મીઠે ઇસ્લામી ભાઈયો ! કુરઆન અરબી ઝબાન (Arabic language) મેં અરબી આકા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ પર નાઝિલ હુવા. રસૂલે અરબી صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ઈસે અરબી લબો લહજે મેં પઢને કા હુકમ કુછ યૂં ઈરશાદ ફરમાયા : اِقْرُؤُوا الْقُرْآنَ بِالْحَوْنِ الْعَرَبِ : યા'ની કુરઆન કો અરબી લબો લહજે મેં પઢો. (1) મગર બદ કિસ્મતી ! મખારિજ કી દુરુસ્તી કે સાથ અરબી લબો લહજે મેં અબ કુરઆને કરીમ પઢને વાલે બહુત હી કમ હેં. ح और ه, ض, ظ, ط, ذ, और ص, س, ث, ش, और ع और ٤, મેં ફર્ક કર કે પઢને વાલે બહુત હી કમ હેં. યાદ રખિયે ! દુરુસ્ત મખારિજ કે સાથ કુરઆન પઢના ફર્ક હે, લહને જલી (યા'ની હર્ફ કો હર્ફ સે બદલને કી વજહ) સે અગર મા'ના ફાસિદ હો જાએ, તો નમાઝ ભી ફાસિદ હો જાતી હે. યુનાન્ચે, યેહી વજહ હે કિ વોહ ઇસ્લામી ભાઈ જો દુરુસ્ત મખારિજ કે સાથ કુરઆને કરીમ પઢના નહીં જાનતે, ઉન્હેં મદ્રસતુલ મદીના બાલિગાન કે તહ્ત દુરુસ્ત મખારિજ કે સાથ કુરઆને કરીમ પઢને પઢાને કા એહતિમામ ક્રિયા જાતા હે. ક્યૂંકિ દો જહાં કે તાજવર, સુલ્તાને બહરો બર صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને આલીશાન હે : يَخْرُجُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ : યા'ની તુમ મેં સબ સે બેહતર વોહ હે, જિસ ને કુરઆન કી તા'લીમ હાસિલ કી ઓર દૂસરોં કો ઈસ કી તા'લીમ દી. (2)

1) نواذر الاصول، الاصل الثالث والخمسون والمائتان في ان القرآن مثله... الخ، 2/232

2) بخاری، کتاب فضائل القرآن، باب خیر کم من... الخ، ص 1299، حدیث: 5024

મદની ફૂલ : બા'દે ઇશા યા બા'દે ફજ્ર મસ્જિદ યા કિસી ભી મકામ પર રોઝાના મદ્રસતુલ મદીના બાલિગાન કી તરકીબ હોની ચાહિયે, અગર ઝેલી હલકોં મેં મદ્રસતુલ મદીના બાલિગાન મઝબૂત હો જાએં તો 12 મદની કામોં કી મદની બહારેં આ સકતી હેં (તફ્સીલી મા'લૂમાત કે લિયે “મદ્રસતુલ મદીના બાલિગાન કે 29 મદની ફૂલ” કા મુતાલાઆ ફરમાએં)

દે શૌકે તિલાવત દે ઝૈકે ઇબાદત

રહૂં બા વુઝૂ મેં સદા યા ઇલાહી (1)

صَلُّوْا عَلَيَّ الْحَيِّبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

﴿5﴾ ચૌક દર્સ

મસ્જિદ ઔર ઘર કે ઇલાવા જિસ ભી મકામ (ચૌક, બાઝાર, સ્કૂલ, કૉલેજ, ઇદારે વગેરા) પર જો મદની દર્સ દિયા જાતા હૈ (ઉસે દા'વતે ઇસ્લામી કી ઇસ્તિલાહ મેં ચૌક દર્સ કહતે હેં. ચૌક દર્સ કા મક્સદ એસે અફરાદ કો નેકી કી દા'વત પહુંચાના હૈ જો મસાજિદ મેં નહીં આતે તાકિ વોહ ભી મસ્જિદ મેં આને વાલે, બા જમાઅત નમાઝ પઢને વાલે બન જાએં ઔર દા'વતે ઇસ્લામી કા મદની પૈગામ કબૂલ કર કે રાહે સુન્નત પર ગામઝન હો જાએં.

મસ્જિદ સે બાહર મુનાસિબ મકામ પર ઇલ્મે દીન કે દર્સ કી મિસાલ સહાબએ કિરામ عَلَيْهِمُ الرِّضْوَان કે મુબારક ઝમાને સે ભી મિલતી હૈ, જૈસા કિ હઝરતે સય્યિદુના શૈખ નસ્ર બિન મુહમ્મદ બિન ઇબ્રાહીમ સમરકન્દી عَلَيْهِ رَحْمَةُ اللهِ الْكُوفِي ને અપની કિતાબ તમ્બીહુલ

1વસાઇલે બખ્શિશ (મુરમ્મ), સ. 102

ગાફીલીન મેં નકલ ફરમાયા હે કિ મુઝે કુકલાએ કિરામ કી એક જમાઅત ને યેહ બાત બતાઈ કિ હઝરતે સય્યિદુના અમીરે મુઆવિયા رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કે દૌરે હુકૂમત મેં એક બાર હઝરતે સય્યિદુના સુમૈર અસ્બહી عَلَيْهِ رَحْمَةُ اللهِ الْكُوفِ મઢીના શરીફ رَأَاهَا اللهُ شَيْرًا فَآءَ تَغَطَّيَّا મેં હાઝિર હુવે તો ક્યા દેખતે હેં કિ એક જગહ લોગોં કા ખૂબ હુજૂમ હે, કિસી સે પૂછા કિ ક્યા માજિરા હે ? તો બતાને વાલે ને અર્ઝ કી : હઝરતે સય્યિદુના અબૂ હુરૈરા رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ હદીસે પાક કા દર્સ દે રહે હેં. યુનાન્ચે, આપ ને ભી આગે બઢ કર ઇલ્મ કે ઉસ સમન્દર સે અપના હિસ્સા વુસૂલ કિયા. ⁽¹⁾

મઢની ફૂલ : ઘડી કા વક્ત મુકરર કર કે રોઝાના ચૌક દર્સ કા એહતિમામ કરેં. મસલન રાત નૌ બજે મઢીના ચૌક, (સાઢે નૌ બજે) બગદાદી ચૌક મેં વગૈરા. છુટ્ટી વાલે દિન એક સે ઝિયાદા મકામાત પર ચૌક દર્સ કા એહતિમામ કીજિયે, મગર હુકૂકે આમ્મા તલફ ન હોં મસલન કિસી મુસલમાન યા જાનવર વગૈરા કા રાસ્તા ન રુકે વરના ગુનાહગાર હોંગે.

(તફ્સીલી મા'લૂમાત કે લિયે ફેઝાને સુન્નાત (જદીદ) સે "દર્સે ફેઝાને સુન્નાત કે 22 મઢની ફૂલ" મુલાહઝા ફરમાઓ)

જો દે રોઝ દો ² દર્સે ફેઝાને સુન્નાત

મેં દેતા હૂં ઉસ કો દુઆએ મઢીના

صَلُّوْا عَلَيَّ الْحَبِيْبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

.....تنبية الغافلين، باب الاخلاص، ص ٦ ملقطًا

યુનાન્યે, વા'ઝો નસીહત કે ઇસી સિલસિલે કો જારી રખતે હુવે દા'વતે ઇસ્લામી કે મદની માહોલ મેં હફતાવાર ઇજતિમાઆત કી તરકીબ કુછ યૂં બનાઈ ગઈ હૈ :

﴿6﴾ હફતાવાર ઇજતિમાઅ

(હદફ : ફી ઝૈલી હલકા કમ અઝ કમ 12 ઇસ્લામી ભાઈ, અવ્વલ તા આખિર શિર્કત)

હર ઇટે બડે શહર મેં (મુતઅલ્લિકા રુકને શૂરા યા નિગરાને કાબીનાત કી ઇજાઝત સે) નમાઝે મગરિબ તા ઇશરાક વ યાશત હફતાવાર ઇજતિમાઅ ક્રિયા જાતા હૈ.

મદની ફૂલ : જિસ નમાઝ કે બા'દ ઇજતિમાઅ હોતા હૈ, વોહ નમાઝ ઇજતિમાઅ વાલી મસ્જિદ મેં બા જમાઅત અદા કી જાએ, હર ઝૈલી હલકે સે કમ અઝ કમ 12 ઇસ્લામી ભાઈ ઝરૂર અવ્વલ તા આખિર યા'ની તિલાવતે કુરઆને કરીમ સે લે કર ઇજતિમાઅ, રાત એ'તિકાફ, તહજજુદ, ફજ્જ ઓર ઇશરાક વ યાશત વગૈરા તક શિર્કત કરેં.

ઝિમ્મેદારાન ઇજતિમાઅ મેં કિસ તરહ શિર્કત કરેં ?

ઝિમ્મેદારાન હફતાવાર ઇજતિમાઅ મેં જબ શિર્કત ફરમાએં તો દર્જે ઝૈલ બાતેં પેશે નઝર રખેં :

✿ ➡ અપને ઝૈલી હલકોં સે ઇસ્લામી ભાઈયોં કો સાથ લે કર આએં.

✿ ➡ એ'તિકાફ કી નિયત સે પૂરી રાત ફેઝાને મદીના / ઇજતિમાઅ વાલી મસ્જિદ મેં બસર કરને કે લિયે મૌસિમ કે લિહાઝ સે ચાદર યા લિહાફ વગૈરા કી તરકીબ ભી બનાએં.

☸☞ નએ ઈસ્લામી ભાઈયોં કો તોહફે મેં દેને કે લિયે હસ્બે તૌફીક કુછ ન કુછ રસાઈલ ભી અપને સાથ લાએં (યેહ રસાઈલ મદની બેગ મેં હોં તો મદીના મદીના, નહીં તો જેબી સાઈઝ રસાઈલ જેબ મેં ડાલ કર લાએં)

☸☞ અપના ખાના સાથ લાએં ઔર ઈજતિમાઅ કે બા'દ અપને અલાકે કે ઈસ્લામી ભાઈયોં કે સાથ હી ખાને કી તરકીબ કરેં. (ઈસ્લામી ભાઈયોં કો ભી અપને સાથ ખાના લાને કી તરગીબ દિલાએં)

☸☞ ઈજતિમાઅ કે બા'દ નએ આને વાલે ઈસ્લામી ભાઈયોં સે આગે બઢ કર પુર તપાક તરીકે સે મુલાકાત વ ઈનફિરાદી કોશિશ કર કે મદની કાફિલે કે લિયે તય્યાર કરેં ઔર અપને પાસ નામ વ ફોન નમ્બર લિખ કર બા'દ મેં રાબિતા ભી કરેં ઔર મૌકઅ કી મુનાસબત સે અમીરે અહલે સુન્નત دَامَتْ بِرَحْمَتُهُمُ الْعَالِيَه کا મુરીદ / તાલિબ બનને કી તરગીબ દિલાએં.

હફતાવાર ઈજતિમાઅ કો મઝબૂત કરને કે મદની ફૂલ

☸☞ નિગરાને કાબીના / નિગરાને ડિવીઝન મુશાવરત, ઈજતિમાઅ ગાહ કે કરીબ રહને વાલે ઈસ્લામી ભાઈયોં કા માહાના મદની મશવરા કરેં.

☸☞ જો ગાડિયાં લે કર આતે હેં, ઉન કે મદની મશવરે ભી કરતે રહેં.

☸☞ હફતાવાર ઈજતિમાઅ કી મજલિસ ઔર ઉન કે ઝિમ્મેદાર બનાએ જાએં ઔર વક્તન ફ વક્તન ઉન કે મદની મશવરે હોતે રહેં.

☸☞ ઝિમ્મેદારાન જદવલ મેં જુમા'રાત અસ્ર તા જુમુઆ ઈશરાક વ યાશત ઈજતિમાઅ વાલી મસ્જિદ કે લિયે મુપ્તસ કર દેં.

☸☞ ખુદ ભી મદની કાફિલે મેં સફર કરેં ઔર દૂસરોં કો ભી સફર કરવાએં.

✿ ➔ મજલિસે હફતાવાર ઇજતિમાઅ એસે અચ્છે મુબલિગ, કારી વ ના'ત ખ્વાન કા જદવલ બનાએ જો મદની મર્કઝ કે મદની ઉસૂલોં કે પાબન્દ હોં.

✿ ➔ હફતાવાર ઇજતિમાઅ મેં શુરકા કી તા'દાદ કમ હો જાના બહુત બડા તન્જીમી નુક્સાન હૈ, લિહાઝા ઇજતિમાઅ કે શુરકા કી તા'દાદ કો બર કરાર રખને કે લિયે મુસલસલ કોશિશ જારી રખેં.

✿ ➔ હફતાવાર ઇજતિમાઅ કે મકામાત બઢાને સે ઝિયાદા લોગ મુસ્તફીઝ હોંગે. **إِنْ شَاءَ اللَّهُ عَزَّ وَجَلَّ**

✿ ➔ નિગરાને ડિવીઝન મુશાવરત / નિગરાને કાબીના ઔર નિગરાને કાબીનાત, મજલિસે જામિઅતુલ મદીના વ મજલિસે મદ્રસતુલ મદીના, હફતાવાર ઇજતિમાઅ મેં જામિઅતુલ મદીના ઔર મદ્રસતુલ મદીના કે તલબા કી શિર્કત કો યકીની બનાએં, નીઝ ઇન કે સરપરસ્ત સાહિબાન કો ભી ઇજતિમાઅ મેં શામિલ કરવાએં.

✿ ➔ ઇજતિમાઅ જદવલ કે મુતાબિક બા'દે મગરિબ સે 2 ઘન્ટે હી હો. ઇસ મેં એક હિકમત યેહ ભી હૈ કિ ડોક્ટર્ઝ, શો'બએ તા'લીમ, મુલાઝિમ પેશા અફરાદ વગૈરા કો સહૂલત હો ઔર ઉન કી ઇજતિમાઅ મેં ઝિયાદા સે ઝિયાદા શિર્કત હો.

જો પાબન્દ હૈ ઇજતિમાઆત કા ભી

મેં દેતા હૂં ઉસ કો દુઆએ મદીના ⁽¹⁾

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

1વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 369

હફતાવાર સુન્નાતો ભરે ઇજતિમાઅ કા જવલ

1	અઝાને મગરિબ	ત્રીન મિનટ	03 મિનટ
2	નમાઝે મગરિબ મઅ અવ્વાબીન	બીસ મિનટ	20 મિનટ
3	તિલાવત સૂરએ મુલક મઅ નિય્યતે	સાત મિનટ	07 મિનટ
4	ના'ત શરીફ મઅ નિય્યતે	પાંચ મિનટ	05 મિનટ
5	સુન્નાતો ભરા બયાન	પચાસ મિનટ	50 મિનટ
6	સુન્નાતે વ આદાબ મઅ 6 દુરૂદે પાક + 2 દુઆએ	દસ મિનટ	10 મિનટ
7	એ'લાનાત	પાંચ મિનટ	05 મિનટ
8	ઝિકુલ્લાહ	પાંચ મિનટ	05 મિનટ
9	દુઆ	દસ મિનટ	10 મિનટ
10	સલાતો સલામ વ ઇખ્તિમાએ મજલિસ કી દુઆ	પાંચ મિનટ	05 મિનટ
કુલ દૌરાનિયા		120 મિનટ	2 ઘન્ટે

સુન્નાતો કી લૂટના જા કે મતાઅ

હો જહાં ભી સુન્નાતો કા ઇજતિમાઅ (1)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٌ

﴿7﴾ યૌમે તા'તીલ એ'તિકાફ

(અતરાફ / ગાઊં, હદફ : ફી હલકા શુરકા કમ અઝા કમ 5

ઈસ્લામી ભાઈ)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! એ'તિકાફ કી નિય્યત સે

अَللّٰهُمَّ صَلِّ عَلَىٰ رَسُوْلِكَ وَسَلِّمْ کી રિઝા હાસિલ કરને કે લિયે મસ્જિદ મેં ઠહરે

1વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 715

રહના ભી એક અઝીમ ઈબાદત હૈ, લિહાઝા દા'વતે ઈસ્લામી કે મદની માહોલ મેં અતરાફે શહર કે લોગોં કો દા'વતે ઈસ્લામી કે મદની માહોલ સે વાબસ્તા કરને કે લિયે બરોઝ જુમુઆ યા ઈતવાર બા'દે ફજા તા નમાઝે જુમુઆ યા હસ્બે મૌકઅ અસ્ર તા મગરિબ એ'તિકાફ કી તરકીબ બનાઈ જાતી હૈ.

યૌમે તા'તીલ એ'તિકાફ કે મદની ફૂલ

- ✽ ➞ અલાકોં સે જો ઈસ્લામી ભાઈ અતરાફ / ગાઊં મેં યૌમે તા'તીલ એ'તિકાફ કે લિયે જાતે હૈં, ઉન કે સાથ જામિઅતુલ મદીના કે તલબએ કિરામ કો ભી તન્ઝીમી તરબિય્યત કે લિયે ભેજા જાએ.
- ✽ ➞ જામિઅતુલ મદીના સે જો તલબએ કિરામ નમાઝે ફજા કે બા'દ કિસી ગાઊં મેં જાએં તો ઉન કે સાથ કિસી ઉસ્તાઝ સાહિબ કી ભી તરકીબ હો.
- ✽ ➞ અવ્વલન સુન્નતેં ઔર દુઆએં સીખને સિખાને કે હલકે લગાએ જાએં.
- ✽ ➞ નમાઝે જુમુઆ સે પહલે અલાકાઈ દૌરા બરાએ નેકી કી દા'વત કી તરકીબ હો.
- ✽ ➞ નમાઝે જુમુઆ કે બા'દ મકામી લોગોં કે દરમિયાન મદની હલકા ઔર બા'દે અસ્ર બયાન કે બા'દ વાપસી કી તરકીબ હો.
- ✽ ➞ જહાં ઈતવાર કો છુટ્ટી હોતી હૈ વહાં યૌમે તા'તીલ એ'તિકાફ કી તરકીબ ઈતવાર કે દિન ઈસ તરહ બનાઈ જાએ કિ અસ્ર સે પહલે અલાકાઈ દૌરા બરાએ નેકી કી દા'વત ઔર અસ્ર કે બા'દ બયાન કી તરકીબ કર લી જાએ.
- ✽ ➞ હફતાવાર છુટ્ટી કે દિન બિલ ખુસૂસ અસાતિઝા, તલબા ઔર નોકરી પેશા અફરાદ કે લિયે સીખને સિખાને કા તરબિય્યતી હલકા ભી લગાયા જા સકતા હૈ, જિસ મેં નમાઝ કે અહકામ સે

જહાં બરાહે રાસ્ત હોને વાલે મદની મુઝાકરે મેં વક્ત કે ફર્ક કી વજહ સે ઈસ્લામી ભાઈયોં કી ઈજતિમાઈ શિર્કત ન હો સકે, વહાં અગલે દિન મદની ચૈનલ પર નશરે મુકરરર ચલને વાલે મદની મુઝાકરે મેં ઈજતિમાઈ તૌર પર શિર્કત કરેં યા હલ્કા સત્હ પર VCD ઈજતિમાઅ કા ઈન્તિઝામ કિયા જાએ, જિસ મેં મક્તબતુલ મદીના સે જારી હોને વાલી કોઈ ભી VCD ચલાઈ જાએ.

﴿9﴾ હફ્તાવાર મદની હલ્કા

મુખ્તલિફ ઝબાન બોલને વાલોં નીઝ શખ્સિયાત ઔર તાજિરાન કે લિયે અલાકાઈ સત્હ પર હફ્તાવાર મદની હલ્કે કી તરકીબ બનાઈ જાતી હે, નીઝ છોટે શહરોં મેં યા ઐસે મકામાત જહાં કિસી વજહ સે હફ્તાવાર ઈજતિમાઅ અભી શુરૂઅ નહીં હો પાયા હફ્તાવાર મદની હલ્કા યા મસ્જિદ ઈજતિમાઅ કી તરકીબ હોતી હે.

હફ્તાવાર મદની હલ્કે કે જદવલ મેં તિલાવત, ના'ત શરીફ, સુન્નતોં ભરે બયાન, દુઆ ઔર દુરૂદો સલામ શામિલ હે. કિસી ભી શહર / અલાકે મેં એક સે ઝાઈદ હફ્તાવાર મદની હલ્કે અલગ અલગ દિનોં ઔર મુખ્તલિફ મકામાત પર લગાએ જા સકતે હેં.

﴿10﴾ અલાકાઈ દૌરા બરાએ નેકી કી દા'વત

(હદફ : શુરકા કમ અઝ કમ 4 ઈસ્લામી ભાઈ)

મર્કઝી મજલિસે શૂરા કી તરફ સે દિયે ગએ તરીકએ કાર કે મુતાબિક હફ્તે મેં એક દિન (બરોઝ બુધ) હર મસ્જિદ કે અતરાફ મેં ઘર ઘર, દુકાન દુકાન જા કર ઘરોં ઔર દુકાનોં મેં મૌજૂદ, જબ કિ રાહ મેં ખડે હુવે ઔર આને જાને વાલે તમામ અફરાદ કો નેકી કી દા'વત પેશ કી જાતી હે, ઈસે અલાકાઈ દૌરા બરાએ નેકી કી દા'વત કહા જાતા હે.

મદીના, કરારે કલ્બો સીના **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** કી મીરાસ તક્સીમ હો રહી હૈ. તુમ જા કર અપના હિસ્સા ક્યૂં વુસૂલ નહીં કરતે ? યેહ સુન કર લોગોં ને પૂછા કિ કહાં મીરાસ તક્સીમ હો રહી હૈ ? તો આપ ને ફરમાયા : મસ્જિદ મેં. વોહ જલ્દી જલ્દી મસ્જિદ કી તરફ ચલ દિયે, મગર આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** વહીં રુકે રહે, વાપસ આ કર ઉન્હોં ને અર્જ કી : હમ ને તો વહાં કોઈ મીરાસ તક્સીમ હોતે નહીં દેખી. દરયાફત ફરમાયા : ફિર તુમ ને ક્યા દેખા ? અર્જ કી : હમ ને દેખા કિ કુછ લોગ નમાઝ પઢ રહે હૈં તો કુછ તિલાવત કર રહે હૈં ઓર કુછ ઇલ્મે દીન હાસિલ કર રહે હૈં. ઇસ પર આપ **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** ને ફરમાયા : યેહી તો દો આલમ કે માલિકો મુખ્તાર બિ ઇઝ્ને પરવર દગાર, મક્કી મદની સરકાર **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** કી મીરાસ હૈ. (1)

ફરમાને અમીરે અહલે સુન્નાત : દા'વતે ઇસ્લામી કા જો બડે સે બડા ઝિમ્મેદાર અલાકાઈ દૌરા બરાએ નેકી કી દા'વત મેં અઝ ઇબ્તિદા તા ઇન્તિહા શિર્કત નહીં કરતા, વોહ મેરે નઝદીક સપ્ત ગૈર ઝિમ્મેદારી કા મુર્તાકિબ હૈ. (જો મજબૂર હૈ વોહ મા'ઝૂર હૈ) હફ્તે મેં એક દિન મખ્સૂસ કર કે અપને ઝૈલી હલ્કે (મસ્જિદ ઓર ઇસ કે અતરાફ) મેં ઘર ઘર, દુકાન દુકાન જા કર નેકી કી દા'વત ઝરૂર દેં. (રિહાઈશી અલાકોં મેં અસ્ર તા મગરિબ યા મગરિબ તા ઇશા, કારોબારી મરાકિઝ મેં ઝોહર યા અસ્ર સે પહલે) અગર

આપ અકેલે હેં તો વાદિયે મિના મેં તન્હા, ખૈમા ખૈમા જા કર નેકી કી દા'વત દેને વાલે મક્કી મદની મહબૂબ **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** કો યાદ કરેં.

દુઆએ અતાર

જો નેકી કી દા'વત કી ધૂમેં મયાએ
મેં દેતા હૂં ઉસ કો દુઆએ મદીના (1)

صَلُّوْا عَلَيَّ الْحَيِّبُ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

માહાના દો મદની કામ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દુન્યા વ આખિરત કી બેહતરી કે લિયે શૈખે તરીકત અમીરે અહલે સુન્નત **دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَه** કે અતાકર્દા ઈસ મદની મક્સદ કો અપના લેં કિ મુઝે અપની ઓર સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કરની હૈ. **إِنْ شَاءَ اللهُ عَزَّوَجَلَّ**

યુનાન્યે, ઈસ મદની મક્સદ કે હુસૂલ કા જો આસાન તરીન રાસ્તા હૈ, ઉસ કે લિયે દર્જે જૈલ માહાના દો મદની કામ ઝરૂરી હેં :

11 મદની કાફિલા

(માહાના હદફ : ફી હલ્કા 12 ઈસ્લામી ભાઈ ત્રીન દિન કે લિયે)

સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કે લિયે રાહે ખુદા મેં સફર કરને કે લિયે દા'વતે ઈસ્લામી કે મદની કાફિલોં કા મુસાફિર બનના બેહદ ઝરૂરી હૈ. ક્યૂંકિ સારી દુન્યા મેં નેકી કી દા'વત મદની કાફિલોં કા મુસાફિર બન કર ભી આમ કી જા સકતી

1વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 369

कदम पर चलते हुवे शैभे तरीकत, अभीरे अडले सुन्नत **دَامَتْ بِرَكَاتُهُمُ الْعَالِيَه** ने मुसलमानों की ईस्लाह के लिये शबो रोज कोशिश की, आप **دَامَتْ بِرَكَاتُهُمُ الْعَالِيَه** हर ईस्लामी भाई को पुसूसी तौर पर मदनी काङ्गिलों में सङ्ग की तरगीब दिलाते रहते हैं, अगर हर ईस्लामी भाई ईनङ्गिरादी कोशिश करने वाले मदनी ईन्आम पर अमल करते हुवे रोजाना द्यो ईस्लामी भाईयों को मदनी काङ्गिले की द्यो'वत दे तो महीने भर में 60 ईस्लामी भाई हुवे, 12 ईसद कामयाबी बी लासिल हो तो हर जैवी हल्के से **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** मदनी काङ्गिला तय्यार हो सकता है और ईस मदनी काम की बरकत से पूरी दुन्या में द्यो'वते ईस्लामी की न सिर्फ धूम मय जायेगी बल्कि कुछ ही असें में द्यो'वते ईस्लामी का येह पैगाम हर मुल्क, हर सूबे, हर शहर, हर गाऊं (Village) हर महल्ले और हर घर में पहुंच जायेगा. **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ**

हर माह मदनी काङ्गिले में सब करें सङ्ग

अल्लाह ! जज़्बा कर अता या रब्बे मुस्तङ्गा (1)

मदनी काङ्गिलों के मुतअख्लिक इरामीने अभीरे अहले सुन्नत

शैभे तरीकत, अभीरे अडले सुन्नत **دَامَتْ بِرَكَاتُهُمُ الْعَالِيَه** मदनी काङ्गिलों की अहम्मियत बयान करते हुवे इरमाते हैं :

﴿1﴾ ➤ द्यो'वते ईस्लामी की बका मदनी काङ्गिलों में है.

﴿2﴾ ➤ मदनी काङ्गिले द्यो'वते ईस्लामी के लिये रीठ की हडी की ह्येसियत रहते हैं.

1वसाईले बष्िशश (मुरम्म), स. 131

«3» ✎ મેરા પસન્દીદા ઈસ્લામી ભાઈ વોહ હૈ જો લાખ સુસ્ત હો, મગર તીન દિન મદની કાફિલે મેં સફર કરતા હો, જો દાઢી ઔર ઝુલ્ફોં સે આરાસ્તા ઔર સુન્નત કે મુતાબિક મદની લિબાસ વ ઈમામા શરીફ સે મુઝય્યન હો. મુઝે કમાઉ બેટે પસન્દ હૈં. (યા'ની જો મદની કાફિલે મેં સફર ઔર મદની ઈન્આમાત પર અમલ કરતે હોં)

«4» ✎ તમામ ઈસ્લામી ભાઈયોં કો બસ યેહી ધુન હોની ચાહિયે કિ જિસ તરહ ભી બન પડે હમ લોગોં કો મદની કાફિલોં કે લિયે તય્યાર કરેં.

«5» ✎ હમારી મંઝિલ મદની કાફિલોં કે ઝરીએ પૂરી દુન્યા મેં સુન્નતોં કી બહારેં આમ કરના હૈ.

«6» ✎ દુન્યાવી યા તન્ઝીમી કામ મેં ચાહે જિતની ભી મસરૂફિયત હો, જબ તક કોઈ માનેએ શરઈ ન હો, હર માહ 3 દિન કે મદની કાફિલે મેં સફર કીજિયે.

«7» ✎ ઈધર ઉધર કી બાતોં કે બજાએ મદની કાફિલોં હી કી બાતેં કીજિયે, આપ કા ઓઢના બિઘોના બસ મદની કાફિલા, મદની કાફિલા, મદની કાફિલા, મદની કાફિલા હો.

જાઈયે નેકી કી દા'વત દીજિયે જા જા કે ઘર
કીજિયે હર માહ મદની કાફિલોં મેં ભી સફર (1)

صَلُّوْا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

1 વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 699

દુઆએ અતાર

ઐ અલ્લાહ **عَزَّوَجَلَّ** ! હર માહ 3 દિન, હર 12 માહ મેં યકમુશ્ત એક માહ ઓર ઉમ્મ ભર મેં યકમુશ્ત 12 માહ કે લિયે તેરી રાહ મેં સફર કરને કી તડપ રખને વાલોં કો ઓર ઉન કે સદકે મુઝે ભી બે હિસાબ બખ્શ દે.

સફર જો કરે કાફિલોં મેં મુસલસલ

મેં દેતા હૂં ઉસ કો દુઆએ મદીના⁽¹⁾

اٰمِيْنَ بِجَاذِ النَّبِيِّ الْاَمِيْنَ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَاٰلِهٖ وَسَلَّمَ

صَلُّوْا عَلَيَّ الْحَبِيْبُ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٌ

﴿12﴾ મદની ઇન્આમાત

(હદદફ : ફી જૈલી હલકા 12 ઇસ્લામી ભાઇ)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત **رَامَتْ بِرَكَاتِهِمْ اَعَالِيَه** ને ઇસ પુર ફિતન દોર મેં નેક્રિયાં કરને ઓર ગુનાહોં સે બચને કે તરીકોં પર મુશ્તમિલ શરીઅતો તરીકત કા જામેઅ મજમૂઆ 72 મદની ઇન્આમાત બ સૂરતે સુવાલાત (Questions) અતા ફરમાયા હૈ. યુનાન્ચે, અપની ઇસ્લાહ કે લિયે ખુદ ભી ઇન મદની ઇન્આમાત પર અમલ કીજિયે ઓર ઇનફિરાદી કોશિશ કરને વાલે મદની ઇન્આમ પર અમલ કે ઝરીએ હર માહ મદની ઇન્આમાત કે કમ અઝ કમ 26 રસાઈલ તક્સીમ કર કે વુસૂલ ફરમાને કી ભી કોશિશ કીજિયે.

1 વસાઈલે બખ્શિશ (મુરમ્મમ), સ. 369

હોગા ઓર **إِنْ شَاءَ اللَّهُ** આપ કે અલાકે મેં કુરઆનો સુન્નત કા મદની કામ ન સિફ યલેગા બલકિ દૌડેગા, નહીં નહીં ઉસ કે તો પર લગ જાએંગે ઓર બે સાપ્તા મદીનએ મુનવ્વરા કી તરફ ઉડના શુરૂઆ કર દેગા ઓર **إِنْ شَاءَ اللَّهُ** દોનો જહાં મેં આપ કા બેડા પાર હોગા.

તૂ વલી અપના બના લે ઉસ કો રબ્બે લમ યઝલ
“મદની ઈઆમાત” પર કરતા હે જો કોઈ અમલ ⁽¹⁾

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

નાય રંગ ઓર શરાબ કા આદી

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો! સુન્નતેં અપનાને ઓર અપના સીના ઈશકે રસૂલ કા મદીના બનાને કે લિયે તબ્લીગે કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે સદા બહાર મદની માહોલ સે હર દમ વાબસ્તા રહિયે. તરગીબ કે લિયે એક ખુશ ગવાર વ મુશ્કબાર મદની બહાર પેશે ખિદમત હે : એક ઈસ્લામી ભાઈ કા તહરીરી બયાન બિત્તસરૂફ પેશે ખિદમત હે : મદની માહોલ સે વાબસ્તા હોને સે પહલે મેં ન સિફ ગુનાહોં કે દલદલ મેં નિહાયત ખુરી તરહ ફંસા હુવા થા બલકિ મેરે અકાઈદ ભી દુરુસ્ત ન થે. નમાઝોં સે ઈસ કદર ગાફિલ થા કિ ઈદ કી નમાઝ પઢના ભી નસીબ ન હોતી. રમઝાનુલ મુબારક મેં તમામ મુસલમાન રોઝા રખતે મગર બદ કિસ્મતી સે મેં ઈસ સઆદત સે મહરૂમ થા. દિન મેં મુલાઝમત કરતા ઓર રાત ભર ચરસ ઓર શરાબ કે નશે

1 વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 635

में धुत रहता. टीवी पर झिंमे द्रामे देખता और बद्द निगाही कर के अपने नामअे आ'माल में गुनाहों के बोज में ठंजाइ करता. शादियों में नाच गाने का शौकीन था. जुल्मते ईस्यां (गुनाहों की तारीकी) से निकलने का सबब येह हुवा कि हमारी दुकान के सामने यन्द ईस्लामी भाई ईजाने सुन्नत से यौक दर्स दिया करते थे. कभी कभार में ली रस्मी तौर पर उस में शिर्कत कर लेता था. वोह बार बार मुजे हइतावार सुन्नतों बरे ईजतिमाअ में शिर्कत की दा'वत देते मगर में हरे बार कोई न कोई बहाना बना लेता. अेक रोज उन की भिन्नत समाजत पर मैं ने ईजतिमाअ में शिर्कत की हामी बर ली और ईजतिमाअ में हाजिर हो गया. जब वहां पहुंचा तो ईजतिमाअ में होने वाले बयान, जिऊ, ना'त, और रिक्कत अंगेज हुआ ने ईस कदर मुतअस्सिर किया कि मेरी जिन्दगी यकसर बद्दल गई. यरस, शराब नोशी और नाच गानों से तौबा कर ली, **اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ** मदनी माहोल की बरकत से पांयों नमाजें मस्जिद में अदा करने वाला बन गया. मुज जैसे गुनाहों में लिथडे हुवे शप्स ने मदनी काइलियों में सइर की बरकत से दीन के अहम मसाईल ली सीध लिये और प्यारे आका **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** की प्यारी प्यारी सुन्नत (दाढी शरीइ) ली सजा ली. मदनी माहोल की बरकत से मेरे बुरे अकीदे की ली ईस्लाह हो गई. **اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ** यौक दर्स और मदनी काइले की बरकत से मुज जैसा नाच रंग का दिल्दाहल और यरस और शराब का आदी सुन्नतों का पैकर बन गया. ता दमे तहरीर अतराइ गाड़िं और पुसूसी ईस्लामी भाईयों में मदनी कामों की धूमें मया रहा हुं.

અલ્લાહ ﷺ કી અમીરે અહલે સુન્નત પર રહમત હો
 ઔર ઉન કે સદકે હમારી બે હિસાબ મગફિરત હો.

أولئین بجای النبی الامین صلی الله تعالیٰ علیه وآله وسلم

અપનાએ જો સદા કે લિયે “સુન્નતે નબી”

મેરી દુઆ હે ખુલ્દ મેં જાએ નબી કે સાથ

ઈસ્લામી ભાઈ “દા’વતે ઈસ્લામી” કા સદા

તુમ મદની કામ કરતે રહો તન દહી કે સાથ

સરકાર હાઝિરી હો મદીને કી બાર બાર

અત્તાર કી હે અર્ઝ બડી આજિઝી કે સાથ (1)

صَلُّوا عَلَيَّ الْحَيِّبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

ઘર મેં મદની માહોલ બનાને કે લિયે

ઘર કે અફરાદ મેં અગર નમાઝોં કી સુસ્તી, બે પદગી,
 ફિલ્મોં ડ્રામોં ઔર ગાને બાજોં કા સિલસિલા હો ઔર આપ અગર
 સરપરસ્ત નહીં હેં, નીઝ ઝન્ને ગાલિબ હે કિ આપ કી નહીં સુની
 જાએગી તો બાર બાર ટોકા ટોક કે બજાએ સબ કો નર્મી કે સાથ
 મક્તબતુલ મદીના સે જારી શુદા સુન્નતોં ભરે બયાનાત કી
 ઓડિયો, વિડિયો કેસિટેં સુનાઈયે, મદની ચૈનલ દિખાઈયે,
 إِنَّ شَاءَ اللهُ عَلَيْهِ

1વસાઈલે બખ્શિશ (મુરમ્મ), સ. 211

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
 أَمَا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ ط

નામ મુબલિલગ :..... માહાના જઢવલ ઝિમ્મઢારી :.....

ફરમાને અમીરે અહલે સુન્નાત صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : જો યેહ યાહતા હૈ કિ મેં ઉસ સે મહબ્બત કરું તો ઉસે યાહિયે કિ ઢા'વતે ઇસ્લામી કા મઢની કામ કરે. ⁽¹⁾

નામ કાબીના વ કાબીનાત :..... મઢની માહ વ સિન :..... ઇસવી માહ વ સિન :.....

મઢી	ઇસવી	ઢિન	મકામ	વકત	પેશગી જઢવલ / મસરૂકિયત કી નોઇયત	કારકઢગી જઢવલ
1						
2						
3						
4						
5						
6						
7						
8						
9						
10						

1 મઢની મુઝાકરા નમ્બર, 150

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

❁ નિગરાને કાબીના કે લિયે : કાબીના કા માહાના મદની મશવરા કિસ તારીખ પર હુવા ?..... કુલ અરાકીને કાબીના :..... કિતને મદની મશવરે મેં હાઝિર હુવે ?..... કુલ ડિવીઝન :..... કિતને ડિવીઝનોં મેં હાઝિરી હુઈ ?.....કિતને ડિવીઝનોં કે મદની મશવરે કિયે ?.....

❁ નિગરાને ડિવીઝન મુશાવરત કે લિયે : ડિવીઝન કા માહાના મદની મશવરા કિસ તારીખ પર હુવા ?.....કુલ અરાકીને ડિવીઝન મુશાવરત :.....કિતને મદની મશવરે મેં હાઝિર હુવે ?.....કુલ હલ્કે :.....કિતને હલ્કોં મેં મદની મશવરે કિયે ?.....

❁ શો'બા ઝિમ્મેદાર કે લિયે : શો'બે કા માહાના મદની મશવરા કિસ તારીખ પર હુવા ?.....કુલ ઝિમ્મેદારાન / મદની મશવરે મેં કિતને આએ ?..... /.....

❁ નિગરાને અલાકાઈ મુશાવરત કે લિયે : અલાકે કા માહાના મદની મશવરા કિસ તારીખ પર હુવા ?.....કુલ અરાકીને અલાકાઈ મુશાવરત :.....કિતને માહાના મદની મશવરે મેં હાઝિર હુવે ?.....કુલ ઝૈલી હલ્કે :.....કિતને ઝૈલી હલ્કોં મેં હાઝિરી હુઈ ?.....દિનોં કી મુસ્તકિલ મસરૂફિયત : હફતા (બા'દે ઈશા હફતાવાર મદની મુઝાકરા), જુમા'રાત (હફતાવાર ઈજતિમાઅ : મગરિબ તા ઈશરાક ચાશત)

માહાના કારકર્દગી કા પુલાસા

મદની કામ	કારકર્દગી	મદની કામ	કારકર્દગી	મદની કામ	કારકર્દગી
કિતને મંગલ તહરીરી કામ કિયા ?		કિતને દિન સદાએ મદીના ?		બા'દે ફજ મદની હલકે મેં શિકત ?	
કિતને હફતાવાર ઈજતિમાઅ મેં બયાનાત કિયે ?		કિતને ડિવીઝનોં કે મદની મશવરે કિયે ?		શો'બાજાત કે કિતને મદની મશવરે કિયે ?	
કિતને હફતાવાર ઈજતિમાઅ મેં શિકત કી ?		કાબીનાત મદની મશવરે મેં શિકત ?		કાબીના કે મદની મશવરે મેં શિકત ?	
કિતને મદની મુઝાકરોં મેં શિકત કી ?		મદની કાફિલે મેં સફર કિતને દિન ?		કિતને દિન ફિકે મદીના કી ?	
કિતને જામિઅતુલ મદીના લિલ બનીન મેં હાઝિરી ?		કિતને મદ્રસતુલ મદીના લિલ બનીન મેં હાઝિરી ?		કિતને અતરાફ/ગારોં મેં હાઝિરી ?	
કિતને રસાઈલ પઢે ?		કિતને અલાકાઈ દૌરા મેં શિકત કી ?		કિતને દિન 2 દર્સ દિયે/સુને ?	

❁ નિગરાને કાબીનાત / નિગરાને કાબીના અપના પેશગી જદવલ હર મદની માહ કી (19 તા 26) ઓર કારકર્દગી જદવલ (યકુમ તા 3) તક અપને મુતઅલ્લિકા નિગરાન કો (jadwal.karkrdagi@dawateislami.net) પર ઈ-મેલ કરેં.

❁ રુક્ને કાબીના ઓર નિગરાને ડિવીઝન મુશાવરત પેશગી વ કારકર્દગી જદવલ કાબીનાત મક્તબ મેં ઈ-મેલ / પોસ્ટ કરેં.

જદવલ બનાને કી તારીખ :.....જમ્અ કરવાને કી તારીખ :.....દસ્તખત :.....

तन्नीमी ँसतलवाहात और मदनी माहोल में राधं ँगर अल्दाअ

ँस के अज्जअे	येड कुँे	ँस के अज्जअे	येड कुँे
काङ्कलवा	मदनी काङ्कलवा	अेक साल का काङ्कलवा	12 माड का मदनी काङ्कलवा
30 ँन का काङ्कलवा	अेक माड का मदनी काङ्कलवा	नलशस्त	मदनी डलका
कन्वेन्स करना	अेडून बनाना / समजाना	भलताअ/लेकयर	अयान
नलकात	मदनी डूल	भीडलंग/मशवरा	मदनी मशवरा
ँन्आमात	मदनी ँन्आमात	मदनी ँन्आमात का कार्ड	मदनी ँन्आमात का रलसाला
काम	मदनी काम	माडोल	मदनी माडोल
डुलया	मदनी डुलया	तरबल्यतल कोर्स	मदनी तरबल्यतल कोर्स
12 रोजा कोर्स	12 रोजा मदनी कोर्स	गुलदस्ता	मदनी गुलदस्ता
येनल	मदनी येनल	पेड	मदनी पेड
तरबल्यत	मदनी तरबल्यत	तरबल्यत गाल	मदनी तरबल्यत गाल
मुजाकरा	मदनी मुजाकरा	टोपी डुर्कअ	मदनी डुर्कअ
स्टाङ्क	मदनी अमला	मर्कज	मदनी मर्कज
यादर	मदनी यादर	स्टेज	मंय
शलडुल/टाँम टेअल	जदवल	रलपोँट	कारकँडगी
टाँगेँट	डदङ्क	मेलनत करँे	कोशलश करँे
राभलता कमेटी	मजललसे राभलता	वलर्ड शूरा	मर्कजी मजललसे शूरा
ँजतलमाअ	सुनतँो अरा ँजतलमाअ	अवातीन का ँजतलमाअ	ँस्वामी अलनँो का ँजतलमाअ
ँरादल	नल्यत	यँीबीस	डअल 12
दङ्कतर, केम्प	मकतअ	डस्पताल	मुस्तशङ्क/कलीनलक
कँद, अन्दा, लडका, आँँ	ँस्वामी आँँ	औरत	ँस्वामी अलन
أئوالمعزوة	नेकी की दल'वत	येड नतीजल नलकवतल डेकल	येड मदनी डूल मलवा डल
V.I.P	शलफलसयत	प्रोग्राम	सललसलवा
नोकर	आदलम	वकङ्क	वकङ्क मदीना
आप ने मुललडल करमाया !	आप ने देआ !	डलीम	अलयडल
डोल करँे	صَلُّوا عَلَی الْحَبِیْب!	डूका रडना	पेट का कुँले मदीना लगाना
आंभँो का डलडकाजत करना	आंभँो का कुँले मदीना लगाना	कुँडूल गोँँ और गँैर जडुरी आतँो से अयना	जअान का कुँले मदीना लगाना
अर अर जल कर तअलीग करना	अर अर जल कर नेकी की दल'वत देना	नमाज के ललये आवाज लगाना	सदलअे मदीना लगाना
आ'जल को गुनलडँो व कुँडूललयात से अयाना		कुँले मदीना लगाना	
मदनी माडोल से वाअस्तगी के आ'द तअलीली आना		मदनी ँन्डलवाअ	

મુલ્કો ઓર શહરો કે તલ્મીમી નામ

ઈસ કે બજાએ	યેહ કહે	ઈસ કે બજાએ	યેહ કહે
સગીદી અરબ	અરબ શરીફ	માનસરહ	મદની સહરા
શ્રીલંકા	સીલંકા	લાડકાના	ફારૂક નગર
સિન્ધ	બાબુલ ઈસ્લામ સિન્ધ	ફૈસલાબાદ	સરદારાબાદ
કરાચી	બાબુલ મદીના કરાચી	સરગોધા	ગુલઝારે તયબા
ઈન્ડિયા / ભારત	હિન્દ	કોટરી	કોટ અતારી
સિયાલકોટ	ઝિયાકોટ	એબટાબાદ	રહમતઆબાદ
લાહૌર	મર્કઝુલ ઔલિયા	નાગપુર	તાજપુર
મુલ્તાન	મદીનતુલ ઔલિયા મુલ્તાન	હરીપુર	સબઝપુર
હૈદરાબાદ	ઝમ ઝમ નગર હૈદરાબાદ		

જામિઅતુલ મદીના ઓર મદ્રસતુલ મદીના વઘૈરા કી ઈસ્તિલાહાત

ઈસ કે બજાએ	યેહ કહે	ઈસ કે બજાએ	યેહ કહે
જામિઆ	જામિઅતુલ મદીના	મદ્રસા	મદ્રસતુલ મદીના
ઈલ્મિયા	અલ મદીનતુલ ઈલ્મિયા	મક્તબ	મક્તબતુલ મદીના
મોનીટર	દરજા ઝિમ્મેદાર	કિચન	મતબખ
ઈન્સિદાન કા રિઝલ્ટ	નતીજાએ ઈન્સિદાન	સ્ટોર	મખઝન
જામિઆ કા ટાઈમ ટેબલ	જામિઅતુલ મદીના કા જદવલ કુલ ટાઈમ જામિઅતુલ મદીના	કુલ ટાઈમ જામિઅતુલ મદીના	કુલ વક્તી જામિઅતુલ મદીના
એસમ્બલી હોલ	દુઆએ મદીના હોલ	મુફ્તી કોર્સ	તખસ્સુસ ફિલ ફિકહ
ક્લાસ	દરજા	એસમ્બલી	દુઆએ મદીના
ચૌકીદાર	બવ્વાબ	તા'લીમી બોર્ડ	મજલિસે તા'લીમી ઉમૂર
સાલાના છુટ્ટિયાં	સાલાના તા'તીલાત	મદ્રસા ઓન લાઈન	મદ્રસતુલ મદીના ઓન લાઈન
મદ્રસા બાલિગાન		મદ્રસતુલ મદીના બરાએ બાલિગાન	

રિશ્તે

ઈસ કે બજાએ	યેહ કહે	ઈસ કે બજાએ	યેહ કહે
બીવી	બચ્ચોં કી અમ્મી	સાલી	બચ્ચોં કી ખાલા
શોહર	મન્સૂબ / બચ્ચોં કે અબ્બૂ	સાસ	બચ્ચોં કી દાદી/નાની
સાલા	બચ્ચોં કે મામૂં	બહનોઈ	બચ્ચોં કે ખાલૂ/ફૂફા
નન્દ	બચ્ચોં કી ફૂફી	દેવર	બચ્ચોં કે ચચા
બચ્ચે / બચ્ચિયાં	મદની મુન્ને / મદની મુન્નિયાં	સુસર	બચ્ચોં કે દાદા / નાના
બચ્ચા / મુન્ના	મદની મુન્ના	બચ્ચી / મુન્ની	મદની મુન્ની

બાલ બચ્ચોં કો સુન્નતોં કા પાબન્દ બનાને કે લિયે

હર નમાઝ કે બા'દ યેહ દુઆ અવ્વલો આખિર દુરૂદ શરીફ કે સાથ એક બાર પઢ લીજિયે, **إِنْ شَاءَ اللَّهُ** બાલ બચ્ચે સુન્નતોં કે પાબન્દ બનેંગે ઓર ઘર મેં મદની માહોલ કાઈમ હોગા. (દુઆ યેહ હે :)

رَبِّنَا هَبْ لَنَا مِنْ أَرْوَاحِنَا وَذُرِّيَّتِنَا أَوْفَىٰ أَعْيُنٍ وَأَجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا ۝

તર્જમએ કન્ઝુલ ઈમાન : ઐ હમારે રબ હમેં દે હમારી બીબિયોં ઓર હમારી

ઔલાદ સે આંખોં કી ઠન્ક ઓર હમેં પરહેઝગારોં કા પેશ્વા બના. (પૃ. ૧૯, الفرقان: ૬૩)

مآخذ و مراجع

نمبر شمار	کتاب	مصنف / مؤلف	مطبوعہ
1.	کنز الامان	اعلیٰ حضرت امام احمد رضا خان، متوفی ۱۳۳۰ھ	مکتبۃ المدینہ باب المدینہ کراچی ۱۳۳۲ھ
2.	نزائین العرفان	صدر الافاضل مفتی نعیم الدین مراد آبادی، متوفی ۱۳۶۷ھ	مکتبۃ المدینہ باب المدینہ کراچی ۱۳۳۳ھ
3.	تفسیر البغوی	امام ابو محمد الحسین بن مسعود فراء بغوی، متوفی ۵۱۶ھ	پشاور ۱۳۳۱ھ
4.	صحیح البخاری	امام ابو عبد اللہ محمد بن اسماعیل بخاری، متوفی ۲۵۶ھ	دار المعرفۃ بیروت ۱۳۴۸ھ
5.	صحیح مسلم	امام ابو الحسین مسلم بن حجاج قشیری، متوفی ۲۶۱ھ	دار الکتب العلمیۃ بیروت 2008ء
6.	سنن ابی داود	امام ابو داود سلیمان بن اشعث سجستانی، متوفی ۲۷۵ھ	دار الکتب العلمیۃ بیروت ۱۳۴۸ھ
7.	سنن الترمذی	امام ابو عیسیٰ محمد بن عیسیٰ ترمذی، متوفی ۲۷۹ھ	دار الکتب العلمیۃ بیروت 2008ء
8.	المستند	امام احمد بن محمد بن حنبل، متوفی ۲۴۱ھ	دار الکتب العلمیۃ بیروت ۱۳۴۹ھ
9.	المعجم الاوسط	حافظ سلیمان بن احمد طبرانی، متوفی ۳۶۰ھ	دار الفکر عمان، ۱۳۲۰ھ
10.	المستدرک علی الصحیحین	امام ابو عبد اللہ محمد بن عبد اللہ حاکم نیشاپوری، متوفی ۴۰۵ھ	دار المعرفۃ، بیروت ۱۳۲۷ھ
11.	حلیۃ الاولیاء	حافظ ابو نعیم احمد بن عبد اللہ اصفہانی شافعی، متوفی ۳۳۰ھ	دار الکتب العلمیۃ، بیروت ۱۳۲۷ھ
12.	الطبقات الکبری	محمد بن سعد بن منیع ہاشمی، متوفی ۲۴۰ھ	دار الکتب العلمیۃ بیروت ۱۳۱۱ھ
13.	نوادیر الاصول	ابو عبد اللہ محمد بن علی بن حسن حکیم ترمذی، متوفی ۳۲۰ھ	دار الکتب العلمیۃ، بیروت ۱۳۱۳ھ

14.	تنبیہ الغافلین	فقیہ ابو اللیث نصر بن محمد سمرقندی، متوفی ۳۷۳ھ	دار الکتب العلمیہ بیروت ۱۴۳۰ھ
15.	منہاج العابدین	امام ابو حامد محمد بن محمد غزالی، متوفی ۵۰۵ھ	دار البیانات الاسلامیہ، بیروت ۱۴۲۲ھ
16.	البدایۃ والنہایۃ	عماد الدین اسماعیل بن عمر ابن کثیر دمشقی، متوفی ۷۷۳ھ	دار المعرفۃ، بیروت ۱۴۲۶ھ
17.	تاریخ الخلفاء	امام جلال الدین عبد الرحمن بن ابی بکر سیوطی، متوفی ۹۱۱ھ	دار الکتب العلمیہ، بیروت 2008ء
18.	مرواۃ المفاتیح	علامہ ملا علی بن سلطان قاری، متوفی ۱۰۱۳ھ	دار الکتب العلمیہ، بیروت ۱۴۲۸ھ
19.	ذوق نعت	مولانا حسن رضا خان قادری، متوفی ۱۳۲۶ھ	شیر برادر ہیڈ، لاہور ۱۳۲۸ھ
20.	مرآۃ المناجیح	مفتی احمد یار خان نعیمی، متوفی ۱۳۹۱ھ	نعیمی کتب خانہ گجرات
21.	مرآۃ المناجیح	مفتی احمد یار خان نعیمی، متوفی ۱۳۹۱ھ	مکتبہ اسلامیہ لاہور
22.	ہمارا اسلام	مفتی محمد خلیل خان برکاتی، متوفی ۱۴۰۵ھ	فرینڈز سٹال، لاہور ۱۴۲۳ھ
23.	فیضان سنت	حضرت علامہ مولانا محمد الیاس قادری دانش تہذیبیہ عالیہ	مکتبہ المدینہ باب المدینہ کراچی ۱۴۲۸ھ
24.	مدنی شیخ سورہ	حضرت علامہ مولانا محمد الیاس قادری دانش تہذیبیہ عالیہ	مکتبہ المدینہ باب المدینہ کراچی ۱۴۲۹ھ
25.	وسائل بخشش (غرضم)	حضرت علامہ مولانا محمد الیاس قادری دانش تہذیبیہ عالیہ	مکتبہ المدینہ باب المدینہ کراچی ۱۴۳۶ھ
26.	شجرہ قادریہ رضویہ فیاتیہ عطاریہ	المدینۃ العلمیہ	مکتبہ المدینہ باب المدینہ کراچی ۱۴۲۹ھ
27.	نیک بنے اور بنانے کے طریقے	المدینۃ العلمیہ	مکتبہ المدینہ باب المدینہ کراچی ۱۴۳۲ھ
28.	فیضان فاروق اعظم	المدینۃ العلمیہ	مکتبہ المدینہ باب المدینہ کراچی ۱۴۳۶ھ
29.	مدنی مذاکرہ نمبر ۱۵۰	حضرت علامہ مولانا محمد الیاس قادری دانش تہذیبیہ عالیہ	غیر مطبوعہ


इंहरिस्त

उनवान	संख्या	उनवान	संख्या
दुइए शरीक की इजीलत	1	¶6¶ इकतावार इंजतिमाअ	41
नेकी की दा'वत का मदनी सकर	1	जिम्मेदारान इंजतिमाअ में किस तरह शिकत करे ?	41
ईनकिरादी कोशिश का नतीजा	4	इकतावार इंजतिमाअ को मजबूत करने के मदनी इल	42
दा'वते ईस्वामी का मदनी सकर	6	इकतावार सुन्तों भरे इंजतिमाअ का जइवल	44
दा'वते ईस्वामी की तन्जीमी तरकीब	9	¶7¶ यौमे ता'तील ओ'तिकाक	44
जैली इलका किसे कइते हैं ?	9	यौमे ता'तील ओ'तिकाक के मदनी इल	45
जैली इलके का मर्कज	10	¶8¶ इकतावार मदनी मुजाकरा	46
मसाजिद की आबादकारी की अइम्भियत	11	¶9¶ इकतावार मदनी इलका	47
दा'वते ईस्वामी मस्जिद भरो		¶10¶ अलाकाई दौरा बराअे नेकी की दा'वत	47
तइरीक है मगर कैसे ?	12	माइलाना दो मदनी काम	51
भारत मदनी कामों की मुप्तसार		¶11¶ मदनी काइला	51
वजाइत	15	मदनी काइलों के मुतअलिक इरामीने अमीरे अइले सुन्त	53
रोजाना के पांच मदनी काम	16	¶12¶ मदनी ईन्आमात	55
¶1¶ सदाअे मदीना	16	मदनी ईन्आमात के मुतअलिक इरामीने अमीरे अइले सुन्त	56
सदाअे मदीना के यन्द मदनी इल	19	नाय रंग और शराब का आदी	57
गली में सदाअे मदीना का तरीका	21	मुस्तकिल इकतावार जइवल	60
¶2¶ बा'दे इज्ज मदनी इलका	22	माइलाना जइवल	61
¶3¶ मस्जिद दर्स	24	माइलाना कारकईगी का पुलासा	64
मस्जिद दर्स के 21 मदनी इल	26	तन्जीमी ईस्तिवाइलत और मदनी माइल	
मस्जिद में दर्स देने के मकासिद	29	में राईज दीगर अइज्ज	65
मदनी दर्स देने का तरीका	31	मुल्कों और शइरों के तन्जीमी नाम	66
दर्स के आभिर में ईस तरह		जामिअतुल मदीना और मद्रसतुल मदीना	
तरगीब दिवाईये !	32	वगैरा की ईस्तिवाइलत	66
¶4¶ मद्रसतुल मदीना बाविगान	36	रिशने	67
¶5¶ यौक दर्स	38	माभजो मराजेअ	68
इकतावार पांच मदनी काम	40	इंहरिस्त	70

नेक नमाजी बनने के लिये

हर जुमा'रात आ'द नमाजे मगरिब आप के यहाँ होने वाले दा'वते ईस्लामी के उड़तावार सुन्नतों वरि ईजतिमाअ में रिआये ईलाही के लिये अच्छी अच्छी नियतों के साथ सारी रात शिर्कत इरमाईये सुन्नतों की तरबियत के लिये मदनी काङ्किले में आशिकाने रसूल के साथ हर माउ तीन दिन सफ़र और सु रोजाना "ङ्किके मदीना" के ङरीअे मदनी ईन्आमात का रिसावा पुर कर के हर मदनी माउ की पडवी तारीख अपने यहाँ के ङिम्मेदार को जम्ब करवाने का मा'भूल बना वीजिये.

मेरा मदनी मक़ाद : "भुजे अपनी ओर सारी दुन्या के लोगों की ईस्लाउ की कोशिश करनी है." إِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ अपनी ईस्लाउ के लिये "मदनी ईन्आमात" पर अमल और सारी दुन्या के लोगों की ईस्लाउ की कोशिश के लिये "मदनी काङ्किलों" में सफ़र करना है. إِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ



—: नाशिर :—

मक़तबतुल मदीना, इँजाने मदीना, त्रीकोनिया बगीचे के सामने, मिरजापूर,
अडमदाबाद, गुजरात-1, फ़ोन : 9327168200

Web : www.dawateislami.net / E-mail : maktabaahmedabad@gmail.com